




માને




૨૦૧૬  
૨૦૧૮



કાલી



શાન્દુરાજાભાઈ



ગાજરાતી સાહિત્ય મિસાન

માર્ગદર્શક

મુજપૂષ્ટ

ડૉ. સુર્દા વ્યાસ  
કા. પ્રતિ દવે

ઉદ્યાં પટેલ  
અવની ગોગરી

નૃત્યાભિજીત પુસ્તક  
સ્પંડન ના.  
સર્વા

મિશન

રસાયનાન

હસ્તી હેઠિયા ચેકતા પટેલ  
રૂપલ સંધારી મોકા રાઈ  
અંજલી વસા જગૃતી પટેલ  
ભૂમી પટેલ  
શ્રોયા નેરાંધી  
ડોલી ચોરલીયા  
પ્રેક્ષણી ભણ  
પૂવી વાદેલા  
દર્શી ચોછાડા  
નિંજલ જગડિયા

નરા લાટિયા  
જચા વાલોદ્રા  
ઉદ્યા વાલોદ્રા  
નિધી હેઠિયા

# અંગુઠમાર્ગિકા

૧. નિર્જન ભગત
૨. નિર્જન ભગતની જીવનચાત્રાં
૩. કષે પરિચય
૪. કવિનું સ્વરૂપ
૫. ભગત સાહેબનો પુસ્તકપ્રેમ
૬. નિર્જન ભગતની કવિતામાં ભારતીય આધુનિકતા
૭. નિર્જન ભગતની કવિતામાં છંડોવિદીન
૮. સંપાદક નિર્જન ભગત
૯. નિર્જન ભગત : જીવનવહી અને  
સાહિત્યસર્જન

# પ્રસ્તાવના

કૃ. જી સોમેયા ડલા અને વાર્ડિગાજય મહાવિદ્યાલયના  
સંસ્થાપક પ્રદેશભૂષણ પુજનીય કરમરીલાઈ નેડાલાલ સોમેયા અને  
ડૉ. શ્રી રાંગિલાલ સોમેયાના આર્થિરાઈ તેમજ ડૉ. સનીરલાઈ  
સોમેયા, શ્રીમતી લીલાબેન ડૌર્ક તપા સગરસ્ત સોમેયા પુરિવારના  
સતત આર્થિક તપા પ્રીત્યાદન થી સાહિત્ય, શિક્ષણ, પ્રવૃત્તિઓ  
ઉત્તોલન ઉન્નતીના પંચ આગળ વધતી રહી છે.

વિદ્યાપીઓમાં રહેલી સુખુમ સાહિત્ય કાળે વેગ  
આપવાનું કાર્ય છેલ્લા ૧૫ વર્ષથી હાથ ટાર્યું છે. આ કાર્ય  
એટલે હસ્તાત્મિકત સામાચિક "રંપંદન" નું પ્રકારાન. આ વખે  
ગુજરાતી સાહિત્ય અંધ્યાના વિદ્યાપીઓ કીવ મળી નિર્મિત લગતને  
અધ્યાંજલી વર્પડા કરતા આ પુસ્તક તૈયાર કર્યું છે.  
કાર્ય બલે એક હોય પણ દરેક જગ્યાના સાપ્તસંદર્ભ  
વિના તે પૂર્ણ રહ્યું નથી. આ કાર્ય પણ વિદ્યાપીઓના  
સાપ્ત રૂપી ન શક્ય પણું છે.

સુધા વ્યાસ  
ડૉ. સુધા વ્યાસ  
માર્ગાચા


ગુજરાતી વિભાગ અધ્યક્ષા

અર્પણ - પુ. સારકણા કરમરી સોમેયા

# નિર્ણય ભગત

"કીર્તિ શ્રી નિર્ણય ભગત વ્યાપકી જવાતંથોતા સામાજિક  
વેતનાના માર્ભિક ગાયક છે. અને તેમનો કાચ્ચાસંગૃહ "છંડોલય" એ  
ઘ્યાતન ગુજરાતી કાવ્યતાનો વ્યેક પ્રતીનિધિ સંગૃહ છે."

- બોળાભાઈ પટેલ.



૧૯૮૮ માં અમદાવાદમાં જન્મેલા નિર્ણયભાઈએ  
પોતાની કાવ્યતાની લૂભિકા વ્યાપતા વ્યાણી નોંધ્યું છે: 'હું નગરનું  
બંતાન છું, એટલુ જ નાહ, હું એઠ વ્યૌધોરીગક નગરનું સંતાન  
છું'

## નિર્ણય લગતની જુવનયાત્રા

દુભુલાઈ - એક વાતાવરણ એ સમર્થનલેખમાં નિર્ણયન લગતે લખ્યું છે : 'પણી જ્યાંક વાંચ્યું કે પરલાઘામાં કવિતા ન કરી, અરાધ્યાવત છે !' પછીનું વિધાન આમ છે : "ત્યાં ૧૯૪૩માં એક હિતસ વર્ગમાં સહાધ્યપાયિની જુદ્ધા લાખીયાએ હોના। જુમધુર કે કેવાળું 'મારી નાડ તમારે હાથ' ગાયું હોની અદલુત વ્યક્તશનો અનુભૂત વિદો પછી ગુજરાતીમાં કવિતા રવાળનું જુદ્ધાં હતું." ત્યારે નિર્ણયન લગતનું વિદીજનાની વર્ષનું હતું અને પદેલું કાલ્ય લખાયું તે 'જીવૃતી', જે ફેલુંયારી, ૧૯૪૫ના 'કુમાર' માં પ્રાચીદ્ય વચ્ચે હતું. તેથે 'નિર્ણયન' એવા નામે, પછીના વર્ષોમાં એમણે ગુજરાતીમાં મન લારીને કાલ્યો લખ્યાં, નિર્ણયન લગત 'નગરનું અંતાન' હતી અને તેથે પાછું 'કૌણ્ઠોગીક નગર' એટલે ગ્રામકુવનની કોડમ એમણી કવિતામાં ન મળે પરંતુ નગર જરાબર દેખાય - ચંદળાય. જોકે પ્રાંતભાની એમણી કવિતા રોમાન્ટિક છે અને ૧૯૪૮ ચી ૧૯૪૮ ના એક દાયકાની કવિતા આધ્યાત્મિક છે. ૧૯૪૮ ચી એમણે કાલ્યાસંજનનાં મૌત પાછ્યું, અને જીતાયે એ કવિ તરીકે ન જુલાયા, ન જુસાયા. એકવાર મશાઈ કવિમિત્ર મંગેરા પાડગાંઠકરના મશાઈમાં કોઈ કવિ આઢાર વર્ષ કાલ્ય ન કરે તો યાદ પણ ન કરે એ મનભાના કથનના સંદર્ભે નિર્ણયન લગતે કોઈ દીરોદાસ નાયકના ગર્વિષ હાસ્ય આચે કચ્છું હતું : 'કોઈ યાદ કરે કે ન કરે એ તો હીડ, પણ મે જ્યારે કાલ્યો કર્યો છે ત્યારે એવાં કાલ્યો કર્યો છે કે હજુ એને વંચનારાં પણ જન્માં નથી, એ તો હજુ સોષ્યો વરસ પછી જામણો !'

પોતાનાં કાલ્યો વિશે આત્મવિશ્વાસથી આવી લાવિ શેખા ધરાવતા નિર્ણયન લગતનો જનમ ૧૮ મ, ૧૯૨૬ માં અમદાવાદમાં, એમના મોસાળ ઘરે, ભાઓ પટેલની પોળમાં, દેવની બોરીમાં, મહાદેવના આંચામાં. પિતૃદાર અને મોસાળધાર ૧૯૨૬ આંદ્રે અંતર જાહેરું એટલે અને દાર વચ્ચે એમનું આગ્રાફુલ વીચું. પિતાનું નામ નરહારિ - નાતાનું નામ મેનાબહેન. નરહારિના પિતા હરિલાલ તજ-ભવિંગના દેપારી હતા અને કિસરવયમાં જમાલપુર ટોકરશાની પોળમાં મગન લગતની જાજનમંડળીમાં ભક્તિય હોવાચી 'લગત' એટું લાડકું નામ એમને જાણું જે પાછળથી તરહારિની ઘરક અની. જોકે મળ ઘરક તો ગાંધી હતી. લગત ઘરક અંદરે નિર્ણયનભાઈ માનતા હતા કે, 'મારી ઘરક એ તો માર એક જીકુસ્થાન છે.' એમના દાદો હરિલાલ નિર્ણયન

ભગતના જનમ પૂર્વે મૃત્યુ પામયા હતો, પરંતુ બેમની લાક્ષીની શાખા પૂર્વતી ભાનગી સંજીવિન, કરતાલ અને કંસરીનોડા પરાચમાં ભયલાયેલાં હતાં. નિરંજન ભગત કહેતા કે 'નાનપદ્ગમાં જ્યારેક મેં ક્રહસ્તે છોનો પ્રયોગ કર્યો હતો!' જોકે છો તો માત્ર 'બાધેસહજ ભંગિતકૈનુક' હતું. દાદીમાં જેકોરલા પાશેથી આજ્યાનો સાંલગણાં મળેલાં.

નિરંજન ભગતના બાપદાયાનું દાર કાળુપૂરશમાં દોશીલાડાની પોળના આચોગાના ઝાંચામાં. એ દશમાં જીવનના આરંભના દમ્પત્તી બેમને રહેવાનું બન્ધુ. પાસે વૈફિગલ મંદિર હતું. પરંતુ તેની વિધિવિધાનવાળી ઘામ્પિંડ છાયા. નિરંજન ભગત પર ન પડી. માત્ર વાસ્તવની અભિ અન્નાઈ. મંદિરના કાતાવરબાજ રચો એ દમ્પત્તી પ્રયેનું બેમનું વલબજ સાવ નોંધું હતું. તુ બેમને નાસ્તિક કહી શકાય, ન આસ્તિક. બેમનો જ નોંધ્યું છે:

"પાસેના ઝાંચામાં અમદાવાહનું ભૌટામાં મોટું વૈફિગલ મંદિર. પદ્ગ મારે મારે એ માત્ર ભાતતાલી ને સંતાદુકડી રમવાનું તથા રાજલોગાની પવાળી જમવાનું કથાન હતું. એમા રોજ રોજ લજનકીર્તિન ઘને હવેલીસંગ્રહિત થાય. પદ્ગ મારે મારે એ માત્ર ભાતતાલી ને સંતાદુકડી રમવાનું તથા રાજલોગાની પવાળી જમવાનું કથાન હતું. એમાં રોજ રોજ લજનકીર્તિન ઘને હવેલીસંગ્રહિત થાય. પદ્ગ મારે મારે એ માત્ર સુન્દર હવેલોથી વિશોધ કંઈ ન હતું. વળી બેમાં રોજ રોજ દશની થાય અને પ્રત્યુત્થે પ્રત્યુત્થે ઉત્સવો થાય. પદ્ગ મારે મારે એ એ માત્ર સુન્દર દશયોથી વિશોધ કંઈ ન હતું. બેમાં રોજ રોજ અલ્પિલગુલાલ ડોડે ઘને અન્તરનો અભિષેક થાય. પદ્ગ મારે મારે એ માત્ર માદક સુગંધ હતી. મંદિરના મુખીયાનીઓ મારા પાડોરીઓ એરલે રોજ રોજ ધરમાં ધીથી નદિનદી આસાપુરી ઘને સાકૃચી બસબસ કોરનો નારતો થાય. પદ્ગ મારે મારે એ માત્ર મધુર સ્વાદ હતો. પદ્ગ મારે મારે એ માત્ર બેક રમકડું હતી. ધરમાં પુળપાઠ દરતો નથી. મંદિરમાં જાતો નથી. લગવાન સાચેનો બંનંદ્ધ આનગરિમાં વિચાર ઇપે કે જાહેરમાં વાડગી ઘને વર્તિન ઇપે વ્યક્ત દરતો નથી. એકાંતમાં મારી જત પાસે કે જાણી કોઈની પાસે હું કદી અકારબાજ હીખરનું નામ ઉચ્ચારતો નથી."

નિરેજન લગતના કાકાનું નામ રામ. એ લેઝિક્સર થયા હતા અને કશ્ટૂરલાઈ, શોદ ભાબે એમને ઘણિષ્ઠ મણી હતી. પાંચ વર્ષ 'લિંગનું ઈન' માં વહેલા અને લંડનથી પાછા ફર્યી જાણ ક્રીસ વર્ધની વચે એમનું અકાઢો અવભાન થયેલું. તિથેશાગમન અને કશ્ટૂરલાઈ સાચે મણીના કાર્બો એમની પાંચ વિલાયતી કપડાનો નોંધો જાઓ હતો. આ બંદર્ને નિરેજન લગતે ભૂચક નોંધ કરી છે. જેમાં એમની તરજાતીને પરિસ્થિતિનો આછો નિર્દેશ પડ્યા મળે છે. નિરેજન લગતના ગાળો આમ છે :

"મારા કદ પ્રમાણો કપાતીને નરેમરચી સિવડાવીને એમનાં કપડાનો તો વરસો લગી ઉપયોગ કર્યો હતી." . . .

"એક વિભાયતી પરાશામાં એમનાં કણગમો જેટલાં અંગેણી ભાણ્ણિયાનાં પુષ્ટકો હતાં. એમાં ભાબે લાલ પુંડાનો પીળા કાગનો લંડનનો એક મોટો પુષ્ટકિકાર નકર્યો હતો. નાનપક્કામાં મેં આ નકર્યો વારેવાર ઓછ્યો હતો. ત્યારે આ નકર્યાના લંડનના વાજમાર્ગો પર મેં વારેવાર નેત્રપ્રવાસ કર્યો હતો અને ક્યારેક લંડનના ઘસલ વાજમાર્ગો પર પ્રવાસ કરવાનું સ્વભા ભેટણું હતું. આજે મારી પાંચ એ નકર્યો હથી."

'અહીં' વાસ્તવ અને જાતિ કલ્પના નિરેજન લગતે લાક્ષ્ય કર્યો છે. ત્યારખાં નેત્રપ્રવાસ નથી, વદ્ધવાસ એમણો બોક્કસ કર્યો હતો અને એ કાળની અનુભૂતિને વિવિધ જાયમાં આલ્યેઝી હતી. તો વળી અન્ય દેશોનો પ્રવાસ કરવાનો એમને બોગ્ય થયો હતો. દરેક સ્થળ પ્રવાસ સાચે એમનો વાંતરપ્રવાસ પણ ચાલતો. જ્યાં જાય નેની જરૂરો અગાઉંથી જાણી લે. ઈતિહાસ મેળવી લે. મંદળો પ્રાપ્ત કરે અને ભાષીમિત્રીને અવગત કરતા રહે. એમની ભાબે પ્રવાસ કરનાર બ્રિટિશહેઠ પાસેથી એ વાત ઝાંખીએ તોય રોમાંચ અનુભવાય !

નિરેજન લગતનું જાળપણ અમદાવાદની પોઠમાં વીત્યું. એમની પોઠમાં જેનોટી વસ્તી હતી. આસપાસનો વિસ્તાર વેપાર-વાડિગીય માટે પ્રાસીદ્ધ હતો. વાતાવરણ પણ એવું જ. ભાબે ભાબે વિશ્વતા અને ક્યારેસ્મા માટે પ્રાસીદ્ધ નરસીંહરાવ, આનંદશાંકર અને દેશાંતલાલનાં નિવાસક્ષાનો ત્યાં હતાં. એક ભાજુ જેને ને બીજી ભાજુ નાગાર વચ્ચે ડિશોર નિરેજનનો ઉછેર થયો. પરિણામે એકીસ્ટ, મંચમ અને વ્યવસ્થાના મુખ્ય ભાંડ. જ એમનાનાં ક સંકોન્ત થયા.

# ઝર્પી પર્સિયા

નિર્દેશન ભગત

જુને ૧૮-૦૪-૧૯૭૭

અપ્સેન દિ ૦૧-૦૫-૧૯૭૮

નિર્દેશન ભગતનો જુને વ્યમદાવાદમાં પડ્ય છેના।  
બ્રોબ્ર વચ્ચોવચ્ચ મંદ્યભાગમાં હંદ્ય સમા આડિયામાં લાખ્યા  
પટેલની પોળમાં દેવની કોણીમાં મોકાણમાં, ચચો હતો. તેમના પિતાનું  
નામ નશ્હેરલાલ અને માતાનું નામ મેના બહેન હતું. વ્યાજુભાજુમાં  
વિક્તારમાં નરીસંહવાલ-વ્યાનેદશાંકુર -કેકવાલ વ્યાદિના વિષ્ટા।  
અને વ્યવસ્થા માટે મૂલિક અંગે નાગાર કુદુરુઓનું વાતાવરકા.  
માતામહ વિદ્યમાન હતાં. એ વ્યમદાવાદના ઓ વચ્ચેની શ્રીમંત  
કુદુરુઓમાંના એક શાબાદી કુદુરુઓના નબીશા, વિક્ષણકા બુદ્ધિના ચતુર  
વ્યાપારી. બાપદાદાનું ધર કાલુપુરમાં દોશીપાડાની પોળમાં સાચોણા  
ઘાંચામાં. વ્યાજુભાજુના વિક્તારમાં વાકીજ્ય અને વ્યવહાર માટે  
મૂલિક અંગે રેન કુદુરુઓનું વાતાવરકા. પાંચેના ઘાંચામાં વ્યમદાવાદનું  
સૌથી મોકું વૈકાશ મંદિર. વ્યેટલે સાથે સાથે બીજાનું પડ્ય વાતાવરકા.  
આ દર અને મોકસાળ વચો પાંચ મિનિટનું વાંતર. એચી મારો  
ઉછેર આ વિર્વિદ્ય વાતાવરકામાં ચચો હતો. પિતામહ તજ-લંગિંગના  
વ્યાપારી. એચી વ્યેમની વ્યરક ગાંધી હતી. પડ્ય ઉત્તરભૂવનમાં એ  
જમાલપુરમાં ટોકલ્યાની પોળમાં મગન ભગતની ભજન મંડળીમાં  
જેણા હતા એચી 'ભગતનું લાડકું નામ પામ્યા હતા. પરીક્ષાએ

બની રહ્યું છે. લાખા વ્યાને સાંદર્થના વ્યાવા જ તેજસ્વી, મેધાવી વ્યાદ્યાપકને તેમની પાસેથી વિદ્યાત્યાસનો લાભ પામેલા વ્યાને ન પામેલા ક્ષે 'ભગતબાહેબ' ના પ્રેમલય્યા સંઘોદનથી વ્યોળાયે છે.

નિર્બંનભાઈ વ્યાજિદન પર્યાત વ્યોપવારીની છે. તો ગોંડી મય. ૧૯૪૩-૪૪ ની પહેલા વિદ્યાજન મૃમાણોની કોમેન્ટરી કર્વિતા પંદ્રા-સોળની ઉમરે કારુ ચંદીને અધિકારી લગાવગ પહેલી પવીએની પૂરી ચાય ત્યાં લગીમાં તો મહો પતી ગઈ છે. તો બીમ વિદ્યાજન મૃમાણોની વ્યાધુનિક કર્વિતા પકા પાંત્રીએ પૂર્વાં ચાય ને પહેલાં જ મહો ચંદી ગઈ છે. એક કુલાકારને માટે વ્યાવા વાલાફેલા જરૂરી વલકે વ્યાનિવાર્ય લેયાય. એક કીલાને માટે ક્રીકિનચ્ચોની વ્યાવી પરિકામકારી વ્યોળાય ખૂબ વ્યાવશ્યક લેયાય. મેધાની પરિપ્રેક્તવાના સંદર્ભમાં વ્યાવી નોંધપાકપડો ખૂચાક, સધન વ્યાને સમૃદ્ધ પ્રવર્ત્તિયારી ઈધાંપ્રેરક ગઠાય. નિર્બંનભાઈને વ્યાનોએ મેધા એજન ભિવાયાના કુઝે લાસ્થાયી નીવડી છે. એટથું ન લેવા કેંપું વ્યાનપાસન વ્યાજે જરૂર છે. બાઢી કેનો 'કોમેન્ટરી પ્રેમીજન' માંથી 'વ્યાધુનિક મનુષ્ય' ને કૃપે વિદ્યાસ ચાયો તે કાચનાચકની, ર્યારલા વરસોના મૌન પછીની, નેચ્ચો કર્વિતા એથે તો તે કેવી હોય તે તો વ્યક્તિ જ નિર્બંનયા-ઈનું વ્યા મૌન કરી કુલગમાંથી જન્મયું છે? કરી રિફ્લેલતામાંથી જમીને ભમ્યું છે? કે પછી એક સભ્યરતા પઢીની બીજુ સભ્યરતા વાચ્યેની એ કરી વ્યાનિવાર્ય વ્યતિરાલ દર્શા છે? કે પછી પેલા પુરિશાષ્ટતા પ્રેમીનું વર્તમાનને વિશેનું વ્યોદાસીન્ય માત્ર છે?

વ્યાવા વ્યાવા મણ્ણો નિર્બંન ભગતનું ભુવનચરિત્ર લાઘનારનું વ્યવરૂપ ધર્શો.

# કૃષ્ણ રૂપન

મારી અને નિર્જનભાઈની પહેલી મુલાકાત થઈ હવે ૧૯૮૦ના દાયકામાં. મારી પત્ની, વંદના, તેમની બિધાર્થીની હતી અને તેમને જાગ્રત્તી હતી. કુશાળના દ્વિપસોથી નિજાંને પદ્ધયા કરતો હતો. મારું બખાડું, એક નોરમાં સંઘરાયેલાં હતાં. વંદનાના આગ્રહી માર્ગદર્શિન મારે તે નોર નિર્જનભાઈને જોવા આપી હતી. એકાદ અફુવાડિયા પછી જચારે મહયા ત્યારે તેમની બાસ્થાંડિક રૂજે એક ટૂકી પ્રણાં કર્યો:

‘આરંભ જ બદ્ધું છે?’

જવાબમાં ‘દા’ સાંભળ્યા પછી એપી જ ટૂકી પ્રતિભાવ:

‘તો બખાડુંની ગુણવત્તા દ્વારા આપી કહેવાચ વધારે લજો.’  
નોર જેતાં જાગાચું કે બદ્ધ જ હંચી ગયા હતા અને જે ગંધું તેના પર નિશાની પડા કરી હતી. તેવી નિશાની વાપું એક કાંચ, ‘હિમાલયનો જલરાશી’, પછીથી ‘પરબુ’ માં છપાયું હતું.  
ત્યાર જાદ ૧૯૮૦ના દાયકાના ઉત્તરાઈમાં મે રવીન્દ્રનાથનાં  
કાંચોની અંગ્રેજુમાંથી અનુવાદ કરવાનો આર્થિક કર્યો. તે  
મધ્યે નિર્જનભાઈ અમારા પરેઝ પરિવારના સર્વય જેવા  
નિદુલભાઈ નાચકના ગાડ સંપર્કમાં હતા. તેમની આચે  
અધારનવાર મહિલાનું છુતું. રવીન્દ્રનાથની અને તેમના  
માદિયની વાતો છતી.

ધીરે ધીરે કુશાળ નિર્જનભાઈની પદ્ધતિની માહિતગાડ  
થતી ગયો. ત્યારે મણે ખજા પડી કે ૧૯૯૧માં રવીન્દ્રનાથના  
મૃત્યુના સમાવાદ સાંભળીને રૂપ વર્ણના નિર્જનભાઈને કહિતા  
લખવાની લાભચ થઈ આપી. મુસ્લિમાંના જઈને અંગ્રેજ  
ગીતાં જાલી તેમજ રવીન્દ્રનાથના અન્ય અંગ્રેજુ કાંચોને  
હંચ્યા અને પછી અંગ્રેજુમાં કહિતા લજો. ત્યાર જાદ  
તેમી જાતે જંગાળી લાખા શીજયા અને જંગાળીમાં પણ  
ગ્રીડ કાંચોની રચના કરી.

આ અનુભવમાંથી તેમણો તારણું કે કહિતા  
માતૃભાષામાં જ બખાચા!

તે સમયે અદવાડિયાના બદા જ વારની સાંજ  
તેમના જુદા જુદા મિત્રોના નામે ગોઠવાઈ ગયોલી હતી.  
માત્ર એક સંગખવારની સાંજ તેમના જાના નામે રાખેલી.  
અને જચારે જા જાણ આપે ત્યારે મારા જેવા જાકીના  
મિત્રોને તે મહતા. માત્ર જચારે મહતા ત્યારે હાત

રહીન્દુનાથની જ હોય. સામાન્યતઃ કુંજી કોઈ વંચતો  
તે અંગોળા ખણ્ણોનું નિરાકરણ કરતા, મારા અનુવાદો  
વંચતા. અને આગામી રૂં વંચવું ને અંગો માર્ગદર્શિન  
આપતા. પાર્વતા કહેતા કે રહીન્દુનાથ જ કાલિદાસના  
સાચા અને એકમાત્ર પારસ છે. ત્યારે કુંજાળી  
શ્રીજ્યો ન હતો અને રહીન્દુસાહિત્ય માત્ર અંગ્રેજુમાં જ  
વંચતો. અંગ્રેજુમાં નવું અકાશન આવે કે કોઈ જૂનું  
પ્રકાશન મળી આવે તો અમે તેના હિંદી વાત કરતા અને  
સામાન્યતઃ એવો આભિગમ પગટ થતો હતી કે ગુજરાતીમાં  
ઉપલબ્ધ રહીન્દુનાથ તેમની બહુમુખી પ્રતિબાને નચાય  
કરે તેમ નથી જંગાળી અને અંગ્રેજુમાંથી ઘડું જધું  
ગુજરાતીમાં બાવવાની આવશ્યકતા છે. નદ્યપરંત ગુજરાતમાં  
અને ગુજરાતીમાં ચચેલું રહીન્દુસાહિત્યનું ઉપલેખભર  
ગુજરાતની બહાર વદ્ધ જવા મારે તેનો અંગ્રેજ અનુવાદ  
થાપો જોઈએ તેમ પડો તેમો માનતા હતા.

૨૦૦૦માં તેમનાં જાનું અપસાન થયું પણ  
મંગળવારની સાંજ મારા ભાગી ફાળપવામાં આવી અને  
અમે નિયામિત અઠવાડિએ એક વાર મહિના માંડ્યા. તેમની  
પાંખીથી રહીન્દુનાથ અને રહીન્દુસાહિત્યની વાતો  
સંભળતા. અને રહીન્દુનાથની હિંદુરસરણી અંગીનું  
તેમનું પોતાનું તાંગુ માંખળીને કુંજાને કુંજાને  
પોતાનું રહીન્દુ-દક્ષિણ ગુજરાતની જનતા સામે પોતાની  
આગામી ઝોલીમાં પ્રસ્તુત કરવું જોઈએ. જંગાળી આશા  
જાડ્યા સિવાય રહીન્દુનાથનો પાંખીચય રાક્યા ન હતો. તેમો  
ઇંગ્રેઝી વાર કણ્ણા કે જાહીનાં વર્ષો રહીન્દુનાથને અર્પિયા  
કરી દેલાં જોઈએ. મારો રહીન્દુનાથ અને રહીન્દુસાહિત્યનું  
રૂસ જોઈને એક દિવસ ભને કરે કે તમારે ઓળાભાઈને  
પણ જોઈએ.

જે દિવસે તેમણે ઓળાભાઈ પરેલ આચે મારો  
પારેચય કરાયો તે દિવસ જુલાય તેમ નથી. તે દિવસ હતો  
મંગળવાર, અપ્રેલ ૧૧, ૨૦૦૭. રૂંજો આડા સ્થાનની  
આસ્પદાય મારી પરની વંદનાઓ દીક્ષા આવીને  
અમાચાર આપ્યા કે રચ્યુથોકનાં વર્ણને કેદ સેન્ટર ઉપર  
સાફ્ટમેર થયું છે. અને અમે અધ્યા જ જમવાના રૂમમાં  
મુક્તિબા ટોલેવિઝન આમે ગોટવાઈ ગયાં અને બીજ રાખ્રે ⑤

આંશી અથડાતા રૂપેનને જોઈએ પણ ખુલ્લું! અન્યાં તો  
 બ્યાજ ચાદ નથી પણ શાકા છે કે હો આ આતંકવાળી  
 દુર્ઘટનાને કાગડો રૂપીન્દ્રભવનની હિન્દાવના એટ્ટ દર  
 થઈ હોય। તે જે દિપસો અમે નેર્દીય લીધો હતો કે  
 હેઠળો કાર્યક્રમ શાહેજહાના મટેલમાં (હાયનું શાહીબાગાંદ્રિય  
 ચાર્ચાંડી જમાદાર મંજુન) - જ્યાં રૂપીન્દ્રનાથ ૧૭ વર્ષની  
 હોય છોડાંક માસ મારે રહ્યા હતા અને જેનું પર્ફીન  
 નૈમદ્ધી બોતાની આત્મકથામાં રહ્યું છે - રાજવી. જે  
 આદટકીયી હેઠળમાં રૂપીન્દ્રનાથ રહ્યા હતા તે હો આજી  
 પણ રાંગીંક જમાદાર હેંડ તરીકે સચબાયો છે. રૂપીન્દ્રનાથ  
 અણી જ બોતાના ગીતોને હેઠળી વાર રસૂલાદે રહ્યો  
 હતા અને તેમની ઝુલ્લિખચાત દ્રુતી વાર્તા. ‘ધૂલિત પાણાદા’  
 અખયાની પ્રેરણાં પણ તેમને અહીં જ એળી હતી. આ જ  
 વાર્તા ઉપરથી જંગાજના દ્વિદર્ભિક, તથન સિંહાસ્ને ૧૦૬૦માં  
 દ્વિભાગ જનાવી હતી જેંકાં ઉત્તરાં અની અકાંચન આનન્દું  
 સંગીતાદ્રશીન હતું. શાકા થાય તો હો હિન્દની પ્રિય - તે  
 સામચે કીલીડીનું માદચામ પચાલિત થયું ન હતું. મીઠાલીને ને  
 અતાપવી અને કાર્યક્રમ રૂપીન્દ્રનાથના જમાદાપણે - ઓની મે - રાજવી.  
 નિર્બંજનભાઈના કહેપાયી કાર્યક્રમી રાજયાનું નક્કી  
 રહ્યું રૂપીન્દ્રનાથ કોઈ હોક ધરમાં જ્યાયી રહ્યા ન હતા. તેમનું  
 પાણિધારીક રહેઠાંકા જોરાસાંકો તેમને ખ્રિય ન હતું અને  
 શાંતિનીકરણમાં પડ્ય તેમણો તેમની મરજુ મુજબ જુદાં જુદાં સરાનોંમાં  
 હોતાં. નિર્બંજનભાઈ કહેતા કે જ્યાં રૂપીન્દ્રનાથની, તેમના  
 આદિલ્યાળી કે તેમના હેઠારીણી વાત કે ચાર્ચી થાય ન  
 તેમનું ધર ચેટલે કે ‘રૂપીન્દ્ર ભવન’ જ કહેપાય. તેમણે જ  
 પહેલેથી નક્કી કર્યું હતું કે ‘રૂપીન્દ્ર ભવન’ને કોઈ નામું કુ  
 સરનામું નહીં હોય! અન્યાં ઉત્સાહપૂર્વી હો કામ ઉપાડી  
 શેતાં અમને લાગતું હતું કે નિર્બંજનભાઈના આત્મામાં

નેડીલા કાપીનું આ રવાન છે. ક્રિઝ્યુઆરી ૨૦૦૨માં હાચેલા કોમી  
રમજાપુરીના કાર્યક્રમી તમી મેની કાર્યક્રમ શાહીભાગમાં રાજ્યવાનું  
ઉપિત ન લાગતો રપીન્ડ્ર ભવનની પ્રથમ કાર્યક્રમ બો ગાર્ડન  
પાસે આપેલા ગજર હોલમાં રાજ્યવાનું માટ્યાં નેંમાં  
રપીન્ડ્રસંગીતથી આર્થિક કરીને, રપીન્ડ્રનાથના તે કાંથગુંચી - નેરેલ  
આને ગીતાંજલિ - વિશ્વી અનુકૂળે ઝોગામાઈ અને નિર્બંજનભાઈએ  
લાલ કરી અને અંતે રપીન્ડ્ર શાતાંડી નિમિત્તે માટ્યજુલ રાથ -  
નીરંગિંદ્રિય રપીન્ડ્રનાથના જીવન ઉપર આધારિત દૃષ્ટાવેજ ક્રિઝ્યુ  
અતાવી. શ્રીચૌપીઠીએ ભરાઈ ગાચેલા ગજર હોલમાં નિર્બંજનભાઈએ  
જીર્ણ કર્ણી મુજબ આજ સુધી - એંજ પર્સ સુધી - ૧૨ મહિને એક  
૧૦૨, રપીન્ડ્ર ભવનની કાર્યક્રમ છતો માટ્યો છે.  
૧૦૨, રપીન્ડ્ર ભવનની કાર્યક્રમનો હેવાલ દ્વારાનારિથત રપીન્ડ્રનાથના  
પ્રથમ કાર્યક્રમનો હેવાલ દ્વારાનારિથત રપીન્ડ્રનાથના  
સ્તુતિજ્યાત અનુવાદી કેતકી ડાચસન અને વિદેશિમે  
મીકલ્યો હતો. જેનીનો સદ્ભાવપૂર્વી પ્રતિનાના આપેલો. રેદ્દિએ મૈ  
રપીન્ડ્ર ભવનને શુંભેરફા પાઠવતાં જ્યાહેલું કે માંન  
અમદાવાદમાં રપીન્ડ્રનાથનો આવાજ સંભળાવવી આપશેડ છે.  
તદૃપરાંત તેમણી જરૂરાંધ્રું હતું કે તેમી નજીકના ભાવેજ્યામાં  
ભારત રાખવાના છે. તે પર્સ નિર્બંજનભાઈ જુલાઈએ  
નિષ્ઠી માર્દીની આપવી અને તેમને અમદાવાદમાં રાખ્યાન  
રાખવા નિમંત્રણ આપવું. તે અમારી એંજ મજયા, પાતચીત  
કર્યું કે નિર્બંજનભાઈએ રેદ્દિએને રૂખરૂ મજવું, રપીન્ડ્ર ભવન  
કર્યું કે નિર્બંજનભાઈએ રેદ્દિએને રૂખરૂ મજવું, રપીન્ડ્ર ભવન  
ચિશી માર્દીની આપવી અને તેમને અમદાવાદમાં રાખ્યાન  
કર્યું. ક્રિઝ્યુઆરી ૨૦૦૩માં તેમનું રાખ્યાન રાજ્યવાનું નષ્ટી થયું.

જી કાર્યક્રમ ૨૦૦૧માં મુલાયી રાજ્યો પડ્યો હતો તેની  
 રેઝિયના વ્યાખ્યાન સાચે જોડી એક અભ્ય કાર્યક્રમ કરવાનું  
 આચ્છોજન પણ કરીનું રઘૈન મદિન આકાર બેદી રહ્યું હતું.  
 મીમદાર, ૨૪ ફેબ્રુઆરી, ૨૦૦૩ની સંજી શાહજહાના મહેલમાં,  
 ગી રમાલાલ સૌનિના મનુષ્યપદ્દ ચીજોની કાર્યક્રમના રેઝિયના  
 વ્યાખ્યાન - રાગોર્ડ પોઝીટિકરનેસ - પછી કિલેસ ડેપિયન આંક  
 દ્વારા, પુરીઓ સંગાવેલી કિલે, 'લાલિત વાધારા'નું રીતિનિંબા  
 ચચ્ચું. એ અસંગી રૂપીન્દ્રનાથ અને અમદાવાદ વર્ષની સમગ્ર  
 કરીઓને આવવી લેલા હિંદુસી પુરુષ - 'અમદાવાદમાં  
 રાગોર્ડ, રાગોર્ડ ઈન અહમદાબાદ' - નું જાનગરી વિતરણ માટે  
 દીમેજ પરિષ્કેર્શાંસ દ્વારા મદાશાન પડ્યું કરવામાં આવ્યું હતું.  
 રેઝિયની પીતાના પુરુષ - 'પાર્ટિસ, જોડિનાં, જોડિનાં,  
 સાઈ' - ઉપર પિંડીંશ ડેઝકાઉન્ટ જાહેર કરીને હેચાપણી  
 ૨૬મ દોમી રમાદાબુરુસ્ટ ચ્યાટિલસોની સહાય માટે દાખલાં  
 આપો હતી. તેઓ એ કાર્યક્રમની પિંડીંશતા અને અફળતાચી  
 હેઠળા અભાધેન ચચા હતા કે ચ્યાદ પછી, અમદાવાદમાં કે  
 અન્યાં, જચાર્દ જચાર્દ તેમને મહાલાનું ચચ્ચું છે ચ્યાડ ચ્યાડ તેમની  
 એ અસંગીને ચાદ કર્યો છે અને રહ્યું છે કે તેમને સાંભળવા  
 આરની મોટી સંજ્ઞામાં ગોતાચી જાચા હોય તેવું જોકે  
 દર્દ્દાંચ જાચ્યું નથી. 'અમદાવાદમાં રાગોર્ડ માટે સામાજી  
 લેટિ કરવા નિર્ણયનાંથી' કઢી ગુજરાતી સાહિત્ય પરિષદનો  
 રિપોર્ટ, 'દીનિંદા રાઈટિંગ્સ આંક રૂપીન્દ્રનાથ રાગોર્ડ,'  
 'નગમંહરાવ હિંદેરિયાની રેઝનિશી,' 'કુદુરાંશ્ના લદની ડાયરી,'  
 રાહિશ્ચક્ર રાખળનું, 'ગુજરાતમાં કલાનાં પગાડ્યાં' દીનિંદાની  
 પુરુષકોની અભ્યાસ કર્યો હતો. સંપાદનનું કામ કેરલી મહીનત  
 અને ચીવર મારી લે છે તેનું પ્રદ્યન્ધ ઉદાહરણ ઉદાહરણ મને જોવા  
 મળ્યું.

૧૦-૨૦માં કઢી ગુજરાતી સાહિત્ય પરિષદમાં રૂપીન્દ્રનાથ  
 એક વિષ્ટ-તાપુર્દી વ્યાખ્યાન આચ્છું હતું, જે 'કંકાદ્રકાન વર્તમાન  
 કીએશાન' ના શિર્ખે નિચે ઉપરોક્ત 'દીનિંદા રાઈટિંગ્સ  
 આંક રૂપીન્દ્રનાથ રાગોર્ડ, વાંચ્યું તીમાં અને અન્યાની  
 સોઝાર્સ સંપાદિત દ્વીપાદ્યમાં અનુષ્ઠાન કરીએશિસ આંક રૂપીન્દ્રનાથ  
 રાગોર્ડમાં, - માત્ર જે જ સંગ્રહોમાં છપાયું હતું. ઉપરોક્ત

- ‘કૃતી ગુજરાતી સાહિત્ય પરિષદનો રિપોર્ટ’ની જાળવામાં હતું  
એક લેખન્દ જેંજનલાઈની નજે પડ્યો, જેણું શીખ્યું  
હતું ‘ડૉ. રાગોજી રિચર્ડાયા’ની સંઝીમ આવૃત્તિ! શરીરોને કેવીનું  
બુધ્યપૂર્વ કરતો અભિ પડી કે આ મૂળ લેખન્દની વાંખીયત  
આવૃત્તિ કેમ કરવામાં હાલી ને હિંદી કોઈ માહિતી ઉપલબ્ધ  
ન હતી. મૂળ લેખન્દી કાશત્રણ કે રાન્ધીપ રિફર પણ મળી  
આવી નથી એને કોઈ એ પણ જાપાનનું ન હતું કે સંપૂર્ણ લૈખ  
‘કૃતી ગુજરાતી સાહિત્ય પરિષદનો રિપોર્ટ’માં હુંપણો છુ.  
આ પ્રેરણની પાછી માહિતી મળી હોય મુદ્દીમાં
- ‘અમદાવાદમાં રાગોર્ડ પ્રેસમાં ખોંચું ગઈ હોયારી સંપૂર્ણ  
લેખ તેમાં તો ન આવી શકાડ્યો પણ રલીન્ડ્ર અપણાના  
પચાનીયી ને ઉપયત્ન નોંધ આવી, દ્વારા રાયર્ડિન્ગમાં  
એક રલીન્ડનાથ રાગોર્ડ, હાય્યુમ જામાં ચપાયો. ને જ  
અમાદ્યે આ જ જમયે દયાઓનાં આંદ્યે કે ૧૮-૩૦ માં રલીન્ડ્રનાં  
પડોદરામાં એક ચ્યાલ્યુનાન આંદ્યે હતું જેણું શીખ્યું હતું  
, મણ દા આર્ડિન્ગ. આ ચ્યાલ્યુનાનની રેન્ડાટ પણ કુચું  
ઉપલબ્ધ ન હતી. તે પણ અમેરિકાસ્થ અમારા મિસ્સિનોની  
નેમજ દંડને રની અહાચથી ગોટી આવે. દ્વારા રાયર્ડિન્ગમાં  
એક રલીન્ડનાથ રાગોર્ડ, હાય્યુમ જામાં ચપાયી

કાર્યિના બાકાર ગતા સ્વાળી તી રવીન્દ્ર રાહિલની બામુદ્દિગાં પડા વીતાનું  
 ગોંગાદાન સાપવાનું શરૂ કરી દીધું હતું. સ્વાળી હતી બાકાર પ્રાઈની તેમના  
 માનસાકાંતાનાના સલરૂપી ધગછ ગઈ રહ્યું હતું. તેની માવજત માર્ટી તેણી  
 સાદા તલ્પર અને તેચાર રહેતા. કાર્યક્રમના આગોજનશી માર્ટીની  
 કાર્યક્રમમાં હજાજી સાપવા રૂધીની તમામ ટાઇક્રે તેમનો ઉત્સાહ  
 માર્ગદરશન અને સહયોગ ઉદાહરણીય રહેતાં. તેણો રવીન્દ્ર સખનના  
 કેન્દ્રમાં હતા અને રવીન્દ્ર સખન તેમના સાઈટિંગ જુખાનું કેન્દ્ર બની  
 રહ્યું હતું. તેમનું અને રવીન્દ્રનાથનું નામ રવીન્દ્ર સખન સાચે જોડાયોલું  
 હોવાચી રવીન્દ્ર સખનને અનેક પ્રતિષ્ઠિત વ્યક્તિ એંબો. તેમજ સંસ્થાઓનો  
 સહયોગ પ્રાપ્ત થાલા રહ્યો. તેમના ઉત્કર સ્વીન્ડ્ર-રસને કાર્યગત તેમને  
 ઘણ્ણાં પૂછતાં કે તેણો શાંતિનિકેતન જર્દ વ્યાપ્તા હે કે નહીં તેણો હસીને  
 હેતા હે કું કચેરે શાંતિનિકેતનની બહાર નીકાજ્યો હોડ એમ મને  
 લાગતું જ નથી! માર્ચ ૨૦૦૫માં વચ્ચે ૮૦ વર્ષની પઢા ઉમંગા, ઉત્સાહ  
 અને ઉળ્ણી, અમને શરમાવે તેવાં! બધે જ જ્વા તેચાર અને દિવસને  
 અંતે પડું ચાડનું નામ નહીં. ચાલવામાં સોચી વ્યાગાળ અને બધી જ  
 માહિતી મેળવવામાં પડા ઉલ્સુડ. તે મુસાફરીથી પ્રેરિત કાચ્યો 'દુમે'માં  
 પગાર ચચ્યાં છે.

# ભગત સાહેબનો પુરુષક્રોમ

તે કૃદાય ૨૦૧૨ કે ૨૦૧૩ ની સાલ હું સાહેબ તેમની બર્ડિયી કસીટોની રૂણી ખમની ઘોલતા હતા. "એમ, અવાજ સચવાઈ જશે?" મેં કહ્યું, "હા - પ્રયત્ન કરીશ. રૈકોર્ડિંગ સારું હૈ, તીવીંધો નહીં આવે."

પછી તો અમારી દર બુધવારની કે દર પંદર દિવસે રિલ્યુ ડરપાની વારી રહેતી 'મે, આ કુસીટ મેં સાંલળી લીધા છે.' નેને હવે કનાર્ય કરી રાકારી. 'આમું ને આમ કામ કરતાં, હું વસ્તુ લાગાલું જ પુછી લેતી, 'સાહેબું, અને હવે પરિષદમાં તમે આપેલા ગુંઘસંચયનું શું કરીશનું નું કર્યારે ગોઠલીશું નું?' તેઓ હસીને કહેતા, 'હા, હા. એ કરીશું ને. હું આતીને ને ત્યાં. અને બીસીને બદું છુંકું પાડી આપીશા, કટીગારી - વાઇઝ.'

પછાં તે વાતો જ રહેતી. અવાજનાર લાગ મળી ત્યારે હું ગેલું પુછી જ લેતી, 'અરે સાહેબ, હવે તો ત્યાં કમાયુટર પણ ગોઠવાયેલું છે.' પછાં મનમાં થાતું, 'સાહેબ, કમાયુટરની મેડામેડ ગોઠવીલા - નિરંજન ભગત ગુંઘસંચય' નાં કલાંબાના કાયમાં મૈયા કરું હું... કે આ મબલાખ ખમની કર્યારે ખુલશી.... હું તેની રાહ મૈયા કરું છું... તેઓ કહેતા, 'મે હુમું ત્યાં નેવું પછાં થયાં નથી, હુમું બીમ દસ્ત વારતે છે એમ કંદા હું જતી થાડી રહેવાનો છું?' અને નિંદાખ રીતે હસી પડતા.

૨૦૧૭માં એ દિવસો અમારી સામે ચાલીને આવ્યા સમાચાર મખાં કે 'ભગતસાહેબું પરિષદમાંનાં તેમનાં પુરુષકીનાં કબાર હવે ગોઠવા આવવાના છે!' કલ્પનાબહેન, રૂપાબહેન, અને હું... ખુશી ખુર્હી દીક્યા આપતાં. ભગતભગ આઠેક હમર પુરુષકી આપીને તેમણે ગુજરાતી સાહિત્ય પરિષદની લાઇબ્રેરીને સમૃદ્ધ કરી દીધા છે. 'નિરંજન ભગત ગુંઘસંચય' ની આ લાઇબ્રેરી પાંચ જાત્યાખે ગોઠવાએ છે, એમ કહી રાકાય! તેઓ પોતાના ઘરે પુરુષકો ગોઠવતાં હતાં, પછી એટલા બદાં પુરુષકી બેગાં થયાં કે ઘરમાં રાયા જન રહી! તે વખતે તેઓ જીવિયસી કુલેજમાં પ્રોફીસર હતા, તેથી કેટલાંક પુરુષકી જીવિયસમાં લદ ગયા. કુલેજમાં અમને પ્રાઇસ્કુલીન આપ્યાં અને ઝમ આપ્યાં પણ આખીય ગ્રાઉન્ડ ફલ્લોર બરાઈ ગયો પછી, કુલેજમાં રિપેર વગેરે ચાલુ થવાનું હતું, તેથી એ લાઇબ્રેરીને તેઓ પાછ્યું ઘરે લદ ગયા. વળી કેટલોક વસોં પછી, વાચનાધીઓના લાલાયું તે લાઇબ્રેરી, ગુજરાતી સાહિત્ય પરિષદમાં, સેકન્ડ ફલ્લોર પર લદ જવામાં આવી અને હવે છેવારે કાયમ માટે, નિરંજન ભગત ગુંઘસંચય' તરીકે પરિષદના બી.

મ. ગુંધાલયમાં ગોડવવામાં આવી છે તેથી કહેતા કે 'ક્રેમ મેં પૌચ ઘર  
બદલ્યા છે, તેમ મારાં પુસ્તકીઓ પણ પાંચ ઘર બદલ્યા છે !'

ગુંધાલયનો ઉંબરો રહતા "ગંગાધ ... મ..." કરીની સાંદરી  
અને ગંગારામભાઈ, દીમિબહીન, સ્નેહલાલાઈ, અન્ય સૌંદરી મેઈ  
ઊભાં રહે. અમારી સહેજ દોડધામ મથી મય... "સાહેબ, પણો  
કું, ખૂશી લાંબ, ટૈબલ મુકુ, પાંડી લાંબુ... " પણ લૂગતસાહેબ  
જીનું નામે - મે મહિનાની લર ગરમીમાં પાંડી પણું એહી, પણો  
શોધું છે કે બંધ તેની તેમને કોઈ પરવાં નહીં તેમને તો દ્વાસ, ડામની  
લગન હતી. આમ હમણો પુસ્તકોના ટગાલામાં ખૂશ વધીને એવી  
તો બોસ, ડામની ડામની લગન હતી. આમ હમારો પુસ્તકોના  
ઢાલામાં ખૂશ ઘણને એવી તો બોસી મય કે મારો કોઈ પોતાના  
બાળકો વરચો ન હોય હીય ! મે ૧૯૧૭ન્ય એ દિવસે એમ  
કબાણોમાંથી પુસ્તકોનો પહેલો છદ્યો કાઢ્યા - હું અવાક થાઇ ગાઈ.  
પુસ્તક પરની દુષ પોતાના દ્વીપણ ખંખેરીને લોગતસાહેબ એક એક  
પુસ્તક ઊંચું - નોચું, ઊંધું - ચચું ફેરફિને કુએ, મારો કે તેમના બિખૂટો  
પડેલો કોઈ પ્રિય સાથી કેટલાય જન્મારે ની મણ્યો હીય ! "આરે, આ  
પુસ્તક મેળવવા લો હું કેટકેટલું રખડયો હતી. અને ખાસ્તા કિંમત  
પણ ચુકપી હતી - તણ રૂપિયા ! "

મને થતું, "તણ રૂપિયા ! ?" તેમ તેથી બોલ્યા, 'તે વખતે  
મારું મન કળ્યું હીય, તેમ તેથી બોલ્યા, 'તે વખતે  
પ્રીફેસારનો પગાર તીસ રૂપિયા હતી - તેમાંથી તણ રૂપિયા એક  
પુસ્તક મારે ખર્ચવાના બહું કહેવાય. તણ રૂપિયામાં તો દીનો ડાઢ્યો  
આવે ! હું દામ પટેલની સ્કૂલમાં, ડાળુપુરુ શાળાનંબર એકમાં  
ભયાતી હતો, ત્યારે હું એક પછનું ચવાદ્યુ લેતો હતો.' પછી  
તેથી હસી પડ્યા.

.... અને આમ તેથી અમને સૌંને તેમની સાથે બૃતકાળમાં લઈ  
જતા અને તેમની રખડપાટમાં અમને પણ ભાગીદાર બનાવતા,  
અમારે મારે ખા એક અર્પિતમણુંની હાથી રહેતો. એક દિવસે  
પુસ્તકોની હુકની વિષે વાત નીકળી તેથી કહે, 'હું પેદર વર્ખની હતો.  
ત્યાથી ચાર - ચાર બાનાની બીપડીઓ ખરીદતો હતો Now my  
collection is more than seventy five years.

વખેણી પણ વાદારે શામયાની શીપડીઓ. તે વાર્ષિકાં, સાંકડી શીરી પાસે  
બે કુડાની હતી. સ્કુલ પાસે ટકા કુડાની હતી. હાજા પટેલાની પીળની સાગે  
એ કુડાન હતી. બાલા હુમાન પાસે ચીક કુડાન હતી. બાલાનોંથી  
કુલેરદાસની એ કુડાન હતી. તે વખતે અમાદાવાદમાં આવી પૌરા-  
દસ કુડાની હતી. પછી અંગેજુ પુસ્તકો માટે ન્યુ અર્ટિકર જુડ કંપની  
આવી. દિનકરભાઈની, રાઉન હોટા પાસે એ બદલ પહેલાની - ૧૯૪૨  
પહેલાની કુડાની. અંદ્રે આનંદ અને સાસ્તુ સાઠેલા એ ટોડોજું ગડાન  
ઢી. ત્રાં એગનાં બસી- પાંચાસી પુસ્તકો મળે. ગાંધાગુજું પહેલું પુસ્તક.  
'આરોગ્ય વિશે સામાન્ય ફાન' શોમાણી છાપીયું."

પુસ્તકો કેળી રીતે લીગા કર્યાં, તે વાત પણ એમને હતીએ,  
'ફરિસામાં શીકસાધિયર કું. બુકરાયાપની માલાદ પણ એવો હતો કે કોઈ  
બાચક પુસ્તક ખરીદા આવે, તો પહેલાં તેનો ગાણી ઇન્ટરવ્યુ લે ! તેને  
પ્રફની પૂછો અનો મેં તેને વાગી કે ખરીદાર ખરેખર એક બાચક છે,  
તો જ તેને પુસ્તક વેરો ! કુડાને નાટાં ગાળે કે ન મળે, પણ એક  
પુસ્તક છોગા જગાઝે જ જું મેદચે !'

તેણી પ્રકારાડી ટૉપરી પણ વાત કરતાં 'Baudelaire's  
તેમને આ પુસ્તક મેદિયું જ હતું. પ્રકારાડાના  
Poem in prose કિંબંધ સર્કરી (સર્કાર) પાસેજું સરનાયું હતું. તીજે કે  
ચીધો માળે જવાનું હતું. સાહેબ ઉપર ગયા. બેટા લગાડાયી પા કે  
અડધા કલાક ચુણા રાદ મેદાપણ કીએછે બાર્દાનું ખોલ્યું નહીં. તેણી  
આ પત્ર લખ્યો છે.' તો સામેદી જવાબમાં પ્રકારાડીએ પુસ્તક જ  
મીડલી આજું અને જુાયું કે 'બિલા ગરવાની રિંગા ન કરશીયું.  
આવી બાચક કવારેક મળે ! લગાડાસાહેબને ચીકએક પુસ્તક થાદ  
હતું. 'કુચી, આ છી, Seven Types Ambiguity - સાત પ્રકારાની

કુભોદત્ત ! આ, Making knowing and judging સર્વોધાર  
 પુસ્તક, જ્યારે આઈન અર્કિસાફ્ડ યુનિવર્સિટીનાં પ્રોફેસર નોમાયા  
 (૧૯૫૬), જ્યારે તેમાંથી ઉદ્ઘાટન પ્રસ્તુતી, Inaugural lecture કરીને  
 આચ્છું હતું. પછી તેનું પુસ્તક થાયું છે.”

ઓમને થાયું કે કેટલાં બદાં હુણાં પુસ્તકી છે. જ્યાથી કેટલાંકી  
 પુસ્તકોની વિગત માટે માટેવા, કું દારે જણો ‘ચીગેજીના’ માઝી શીધપાણી  
 પ્રત્યાન કરી, તી નોંધ આવની કે ‘પુસ્તકી પ્રાર્થનાણી - નોંધ  
 અવેલેબલ?’ ભગતસાહેબના ગુંધારીથારામાં આવી તી કેટલાંય પુસ્તકી  
 છેની વર્ણણે જુની કાપાણી નીકળતી : બાળગોંપદ કુલેરદાસ -  
 કેડાચું, બાલા છનુમાન એ કુઠાનમાંથી ખરીદારોલાં સાહિત્યનાં  
 પુસ્તકોનું બિલ, કું તી વળી કેટલાંક વર્ષી માર્કિનમાં તેમના હાથે  
 લખાયેલી, કીકુંગારલારી નોંધ નીકળે - એટી તી સંશોધનાટકોન  
 નોંધ કે તેમાંથી કદાચ એક પુસ્તક જ હેઠાર થઈ મથ્યા। કેટલાંક  
 એવાં મંગેજિની પણ નીકળ્યાં, કું જેના ધોડાંક જ અંકોનું પ્રકારન  
 થાયું. હીથ અને પછી પ્રકારનાં બંધ થાગયું હીથ. સાહેબો રહેતા,  
 ‘મારી પાસે આ - બદાં જ મંગેજિની સારાદારાં છે.’

ભગતસાહેબે ઓમને એક પુસ્તક બલાયીને કહ્યું, ‘This lady  
 વિકટોરિયા  
 was in love with Tagore. very brilliant lady. આંકાંધી. ટાગોરને તેમાંથી એ ખુરચ્છી લેટમાં અધિક હતી, કું જેનાં  
 પર બેસીને ટાગોર પૌત્રાની સમય વિતાવત્તા હતી...’ અમે રફીંજે  
 ભાવનમાં આ વાત કરવાનાં છીએ.

આમ એક પછી એક ડાબાણાં ખૂલતાં ગતાં અને તેમાંથી  
 વેવિદ્યસભાર લંડાર બીલરાની રહેતી. કવારેક સાહેબ તેમની રિસ્પૉન્સ  
 જરૂર ઉમેન્ટા, “Oxford companion of American of Ezra  
 Pound આ પુસ્તક અધ્યક્ષ અધ્યક્ષ એ - criticism માં હુંયું.

collected poems of Ezra Pound... can Man survive....  
 China India and ruins of Washington.... God save  
 Englishman.... culture can kill us.... આજ સાવરે જ હું  
 હોવ કરતો હતી, કે 'Assimilation' નામનું પુરતક આય્યુનથી  
 એવેલ ધારાં પુસ્તકો બાકી રહી ગયાં હશે. એ પુસ્તકમાં ગિતાન  
 'વર્ષ પરચીમ - યુદ્ધકાળ્ય' રજાઓ છે. "આમ સાહુબ પાસે તેમના  
 એક એક પુસ્તકની માહિતી હતી અને એ ઉપરે ઝીકાવાટબરી વાતી  
 તેમને ધૂદ હતી.

એનભી - એલાઇનસ્ટોઅન - શ્રી આરચિંદ ... વગેરે પુસ્તકી નિકળતું  
 ભેટને એમને ધતું કે સાહુબને વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન વગેરેમાં પણ રસાયન  
 ત્યારે તેમણે કણ્ણું કે, 'મેં ૨૦ વર્ષ લગ્ની, લગ્નભગ્ન '૭૦ થી '૮૦ ની સાલ  
 જુદ્ધાં, Science & Religion વાંચ્યું હતું અને લિટરેરી બંધું નહોતું  
 વાંચ્યું. માત્ર કૃત્વાખતા હતી એવેલે કે 'out of curiosity' મારે  
 મણાવું હતું કે કું કયા જગતમાં મળી રહ્યો છું. એ પુસ્તકની વાત  
 કરીએ, તો chance and necessity - એક પખત જ્યાદી મૌઠી ચર્ચા  
 ચાલી હતી કે એ યુનિવર્સ ચાન્સથી ચાલે છે કે નેસે સિટીથી. એ  
 ચર્ચા In a nation of strangers, અમેરિકામાં ચાલી હતી... !'

આમ જે પુસ્તક હાથમાં લે, તેના વિશે તેની સંદર્ભસમૂહિત  
 હોય જ તેમણે કણ્ણું, "Passage to India - આ પુસ્તક મેં લક્ષાવેલું  
 છે. તેની વાતાં કઈ આવી છી, ફિલ્મો અંગે છે અઝીજ ઇન્ડિયન  
 છે. બંને પરમ મિત્રો છે. ફિલ્મોનું ૨૭ ગાળવાં હંલન જ્યાનો છો.  
 ત્યારે બંને મળે છે - એકદિમને વિદાય કરવા. ફિલ્મો કહે છે કે હું  
 કું પાછી આવિશ, ત્યારે આપણું મળીશું. ત્યારે અઝીજ તેને કહે છે  
 કું ના, આપણું નહીં મળીશે, હું તને નહીં મળું, ફિલ્મો પુછો  
 છે કે શા માટે નહીં? ત્યારે અઝીજ કહે છે, "To the British  
 quit India, we can't be friends" તે પણી અટકીને ભગતસાહેબે  
 કણ્ણું કે, 'એ કું ના, આ કું ના' શાંત આમાંથી આય્યો છે. ફિલ્મોનું  
 છે કે 'Who says no... ' વગેરે. "ત્યારે પછી તે પુસ્તકનાં  
 લોખ, વિશે હેઠાં, 'E.M. Forster અમદાવાદ પડ્યા આવી ગયેલા  
 ભારતમાં ભોપાલની બ્યાંકમાં એક રજાતું હતું. ત્યારે તૈયી  
 રીકાચા હતા. અને ત્યાં પાંચેક વધ રહ્યું હતું. તેથી એ પુસ્તકની  
 ઘડકી વાત Forster ના પોતાના અનુભવામાંથી હણી છે.

આમ જેમ જેમ પુસ્તકો નીકળો, તેમ તેમ તેઓ વાતો કરતાં,  
"આપણો સિલ્વિયા ખાચ વિશે વાત કરી હતી ને, તેનું આ પુસ્તક."

મને અચકાર થતો કે હું તો સંદર્ભ ભૂલી ગઈ હતી કે આમારે શું  
વાત થઈ હતી તો સાહેબે વાદ કરાવતા કે ઝૂબ જ ડિપ્રેશનમાં  
જઈને આ કવિત્રીએ બે-જીતા વાર આવધાતનો પ્રયત્ન કર્યો  
હતો અને છેલ્લા પ્રયાસમાં તે મૃત્યુ પામી હતી આમ ક્યારેક  
પુસ્તક વિશે, તો ક્યારેક પ્રકારાન વિશે વાત કરના તેઓ કહેતાં,  
"આ પુસ્તકનું પ્રકારાન કેલું સરસા છે - આ પુસ્તક, 'Bibliography  
of John Donne,' એ જહોન ડનાની વસ્તુઓ લંડનમાં કર્યાં કર્યાં  
છે તેની લિબિલીયો ગ્રાહી છે તે મારે કેટલું મોટું દળધાર પુસ્તક  
પ્રકાશિત થયું છે! તે કર્યાં કર્યાં ગયો હતો, વગેરે વગેરે ભાલનોંનો  
પ્રકાર તેમાં રામાવેશ છે.

## નિર્ણય સમાનની કવિતામાં લાઘ્વીય આધુનિકતા

લેખની શરૂઆતમાં જ વૈક વાત નોંધ લેવી જરૂરી ગણાયું ને મ કીલતાની તેમ વાદુનિકતાની વ્યોગાચ વૈક સીમાદી વધારે નિશ્ચિત થઈ આય, તી રથગાત થઈ જતી એ વ્યોગાચ, વ્યોગાચનાર વાને વ્યોગાચાવનાર જેને મારે અચિતકર જેને, 'વાદુનિકતા' - જોને 'કવિતા' જેને સીજાચીનો સંકૃત વિસ્તાર વાપાર છે. વૈકલે જ એ જેના અનેબન્ધનીએ જેનેક પ્રવિમાણો છે. દશક કુદાજ જેમની કવિતાની પ્રલાપ પ્રગરના ગુરુત્વાત્મે માની છે એને જીમ દશાધીની પ્રગ્રહ પ્રશ્નજીવની, એવા નિર્ણન ભાતની ઉપિતામાં, જીતાતારની એને વાતકીને એકુલ હીતાસ ધરાવતી વાદુનિકતા કરી કરી રેત વ્યક્ત થાય છે, એવી પૂરી એને વિગતાર ગાયો એ મુદ્યાદિત પ્રકૃષ્ટિશ્ચા ધરાવતા તોષમાં કરવી એ ગાય બલરનું કામ ગણાય. એટલે એમોદી માણ તેણ ગુદાચી પર એ લેખ ડેન્ડ્રોય કર્યો છે, એમ ધારીને કે એમ કરી રેખની કાઢમયાદી એને, આસ તે એ પેણના પેણની જાચાડાશે! એ કાળ મુદ્દા, અંકી ગાળ અદાદે એ મુર્જા છે : ૧. વાદુનિકતા એવાના પાચામાં રહેલી વ્યોગોનિક કોણાં એને એવાનાં મુદ્દામાં રહેલાં થીતવિજ્ઞાન એવી નિર્ણન પ્રગપતો એક તકનિક વિચારક તરીકોનો વાર્તાગમ હો ઇનો ૨. વાદુનિકતાના સમયમાં રાજ્યસત્તા એવેને એવી લુભિકારૂપ વ્યર્થમાં આદી રહા, વિરોધે આહિત્યના ભાગનંદ એંગે એક એ સર્જા - નિર્ભય નાગરિક તરીકે એ શું રીતચારતા ઇતા ૩. ઉપિવર નિર્ણન ભગતની કવિતાની સમગ્રતાની સંબંધ વાદુનિકતા સાથે કેવો છે - તેની એક તાજકે રથગાત વર્ણને વારુદી ગાયેલી કે એવી તમારી તાજકો કુદાજ ક્રીએની એને હું વાયને વાચને વિકવતનો જનો ૪.

એ તકનિક વિચારક, સર્જા - નિર્ભય નાગરિક એવાને કરુતાએ કોણ, ગાળ પરસ્પર કરી રીતે વંકળતા આન્ધા છે, એ પેળ હૃતિલો હારા મુખ્યપાપાનો આ લેખમાં પ્રયાસ થાણી રહેશે.

બાધુનિકતા બાધના પણ પ્રભૂત છે કે વાપર કે  
 જ્યાં કે ટલાં સમાચારી હો દુનિકના અર્થાત બાધનાપણું  
 હોક વીતી ગાયેની ગઈ કાંઈ વધવા, કરેન જ્યાં  
 શકે હોવી બાપતી કાંઈ જની ગઈ છે? પારત્યાખામાં  
 પુછતાં, કેં ચેલી બાધુનિકતા હો વણું- બાધુનિક  
 વધવા વિકાંપે હૃતિદાસીતર જની ગઈ છે? કેલાં  
 હૃતિદાસપદો બાધનામી સદીના ઉત્તરાર્થી હૃતિદાસ  
 રિવીલ્યુશન કહેતાં જોડોગાડ કાના બાધી પુરાંપમાં  
 જન્મેલી બાધુનિકતાને વિશ્વાસી સદીના વીત પહેલાં  
 વધવાન પાર્થેલી ગળી છે. જ્યાં કૌરવા હ્યોતાર  
 ને કેન્દ્રિક જૈરામન જીવા વિદ્યારકી 'દ પોર્ટ મીહન  
 કુંદ્રાન' વિને 'કલ્યાણ પોર્ટ કેપિયાલજમ' ની  
 આમીના લીલાએ ભદીના વ્યેતમ થરણમાં પ્રભૂત  
 કરે છે એની ગોડનીંટીના વીતની ઘોખણા કરે છે.  
 વિકાંપે જોકી કંઠાકીને મતે મુડીવાદ બાજી વીઠો  
 તો પુર્ણપણે વિકાંપત રખેની સારદ્યવાન જની ગાયો  
 છે કે બાધુનિક માનવનો હૃતિદાસ, જેના પુરુષાર્થી  
 કહાણી હો પરિપૂર્ણ, સમાપ્ત ઘણી ગઈ છે. કાર્યક્રમાં  
 હૃતિદાસ એ મત કરે છે. તો વાન્ય હૃતિદાસપદી  
 માને છે કે બાધુનિકતા તો બાર્દેદી નવાં વિવલીમાં  
 વાગધંદ્ય છે. ચુરીન હાલોરમાસ મોડનીરી ને જૈનલાર્થન્ટમેન્ટ  
 ની ચુંબક બાબુ પર હૃતિદાસ થયેલી ગળી, મોડનીરીની  
 વીક 'અનદ્રિનિશ્ટ પ્રોજેક્ટ', ૧૯૮૦ માં પ્રકાશિત  
 પુસ્તકમાં ગળી છે. નિર્દેશન ભગત જેકી એ મતલેણીની  
 કે એ વિદ્યારકીનો લીગાતે ઉત્તેજ કરતા નથી, એવા  
 યોગનું પલણ હાલેરમાસના મેતાયની વધારે નશેકનું  
 હોય, વીં જણાય છે. વિદ્યારક રૂપે નિર્દેશન જગતની  
 એની સામર્થ્ય એ હો કે એ વિદ્યારની શાખાપુરણાં  
 -જીવીને નાણી, જીતાં જુલાની, જેટું જીની કર સિરદમ

રહેતાં મુગ-જળને, મુગ-યવસાયને તપાસતા રહે છે.  
સાહિત્યશાલા માં ડૉ. કણ્ઠશાયમ, પેરિક્રિસ, દિલ્લીઓફિલ્મ્સ,  
પર્ઝિલ, હોરેસ, કુન્ડી, અન્યાંથી અને પુષ્ટિકન બાદ  
અનેકોન પોલપોતાનાં રૂધળ-કાળમાં મુક્કી આપ્યા પણ  
નિર્મંજન અગત એ વસુને પોલાની રીક્ષકૃતિમી માસાના વ્યૌદ્ધ  
મહાવાક્યમાં પરસ્પર જેવી આપે છે. આમ, આદ્યાનકૃતાની  
શૈખાની અમણજ વ્યૌદ્ધ રીતા અને યાપક મુગ-જળમાંની  
પોષણ પાભીને પિક્કમતી રહે છે.

નોંધીનોંધ કાના અને રૂધુનિકતા બે ફેરફાર  
 રહ્યોને જઈ શકે : માણસભાની પૌત્રાની ધિનારા કરજી  
 ત્યારે એ કાર્યવાચામાં રૂધુનિકતાનું પરમોદર્ઢિજીંદુ હોલી  
 શકે. આયા લો રૂધુનિક માનદા અને સમાજ પૌત્રાની  
 રૂધુનિ જીવાચો હોઈએ નિશ્ચી નેને 'રૂધુનિકતા |  
 સુપરમેન' ઉહેતા હોલી પ્રભિતમાર્ય પૌત્રાની પદરે, વ્યોદા  
 રૂધુનિ રૂધુનિકતાનું ઉપાનતર થાય. એ જેમાણી  
 એક વંત સુધી એ પડ્યો. ત્યાં સુધી રૂધુનિકતા રીતરસરળ  
 હું. નિર્બંજન અગતને ગાણસભાની કાનનિર્મિતાની એની  
 ટેક્નોલોજીની શક્તિથીમાં પાચાનો, નિર્મિતાચાન, એપાણ  
 વિશ્વાસ હતી. એમની રૂધુનિકતા સાચેની સરબનધ  
 એ, અમાજાણ પર રૂધુનિકતાની. એટો લોલારિક એની  
 વિજ્ઞાનાત્મક ભૂભિકાથી રણની નિર્બંજન લગત, કલિ રૂપે એની  
 નાગરિક - અનુભૂતિ શ્રેષ્ઠ આધુનિકતાને હોટલે હું  
 નોંધીનોંધ કાના હારા. માનપજુલને સર્જાણી હીની પૌત્રાની  
 નિર્ધેનામાં લેનારી રૂધુનિકતાની સમજત! એની પડ્ફરતા  
 કો એની, લોજ તરક, એ કલિ - લિલારક કૂદૈલા રહેલા કુ  
 પૂકૃતાના એની રૂધુનિક માનપરીકૃતિ દરાઘ છે. પૌત્રાની  
 વિજ્ઞાનશક્તિની, સાંચોધે તો 'ચીગિપિકાન' શક્તિની  
 એ અનુભૂતિના અનુભૂતિ રહેલી રૂધુનિકતાની એ  
 એમ કરપાની વખતમાં હું, એટું હું માનતા.

‘હો પૂર્ણપારથે રહીને કરી નિર્ભંજન આતે, જોદેલે  
અને હોલિયર - ઓડેનને માર્ગ, જાળિક શાદુનિકલાની  
ગુણગામી ગીતાંસાં, પૌત્રાંસ રખનેં વ્યાજ્યાનો, વાતદીતો  
વધને વિચાર, રૂપે ગૃહીયોમાં કરી છે ‘શાદુનિક કરીતા’  
'ડોરલાએ પુસ્તનો' હો પૂર્ણપણે કોમણે ગુજરાતી કરીતા અને  
શેરૂપાની રહીએટો શાદુનિકતાની શર્યા કરી છે. કહી રૂપે  
પણ 'ખાદ્યાશાને માનદાદારી મણીજા હું' કાણે જોઈ  
શરીરામાં ચાસ્ટાત્ય વિચારકોણી વ્યાખ્યા હોયા, ડેલે-શો-૧૮-  
(દાદીએ વ્યાખ્યા)૧૮૧૬ - નિરારીદાદીએ ઘરનું ખાગા જતી,  
શાદુનિકતાએ વેરાંય શીપનાયકત વારતીય વિચારના  
પ્રસ્તુત કરે છે.

મેડુ, વ્યાલિન, વ્યેક વિચારણ કરી રૂપે પુર્ણ -  
નિર્ભંજને પૂર્ણરાગી 'પ્રવાનહીપ' નાં કાણીમાં અને  
ઉત્તાર - નિર્ભંજને શાદુનિકતાનાં કાત્યારોધક, પરનિરીંશ,  
અમદીલેનશૂન્યે અને સાનાઓએ પરિખળીની શ્વાસી,  
દ્વિતીયાના કુરી છે. પણ અમગૃહયાં શાદુનિકતા મારાંશ અતિને  
ખૂબ અને અનુભૂવીને પિનાશાને આર્ગ લઈ જાય છે.  
શાદુનિકતા અનુભૂવીને પિનાશક સાલિત થાકે વૈધું નિર્ભંજનને  
અંગાત રોડિન, વિચારક કે કરી રૂપે માનતા નથોતા.  
સ્પેલિયર, ઓડેન, ક્રોકર; જોદેલર, અરી, પિરાન્દેલો;  
કોકેવિસ, કાસિમોદી, મોનાલે - અથ અનુભૂતાં  
વિશેના મર્ગામી રાને શાનિરસગાંધીની નેચ્ચાંદી રૂપાદ્યાયાનોસ  
૧, ૩, ૪ અને સાંચાયચાર્યાની ની માનોલુંની જાહેરાં  
શાલીઝાન હે પણ દોષોથી પરંધી, કુર્કાંદ, કાદુંદા;  
લોન્ડર જોંઝમિન, ઢાના શારોંડ, એડોનો; કચ્ચી, રીસ  
સ્ટ્રુક્ચર, ગ્રાનિટી, સાર્ગ; આઉફિયાન્ડ, જુલેન્નાંડ,  
ગોર્ડિલન્ડ - શાદુનિકતાની શાલીશાનાંસ અથ પાસ્સનો  
રૂપાદ્યાય નિર્ભંજનમાં આર્ગી જીવા નથી મળતી.

એકુંડ વારતીય શાદ્યનિકાલા હોય. વારતમાં શોધીને  
 કાળા, નિર્જન વગતના શાદ્યેમાં 'શ્રીવિકાન' ની હુંગ,  
 શાદ્યાનિસમી ચાદીઓ જીજ દરખાસ્તાના, તેથી બેન્દ્યાનાંથી  
 પિદેશી જીજાના રહ્યુંથા નીચો, ઘઢી. એ વારતીય શોધીને  
 કાળા અને વારતીય શાદ્યનિકાલા વિશેની નિર્જન વગતની  
 સમજણા ગાંધી હુંગ હુંગ વિશેની પૂર્વાપ નીચો હશી.  
 પણ વિશેની વધી ક સમર્થ રાંધ્રાંદીની માર્ગાનીની  
 રાતાર સેંદર્ફ નિર્જનક વગતના રિઝાનાં રહ્યાયી હો, વીરની  
 ગોંડવિચારની મૂલાં નિર્જન નિજ ની ગતી હતી.  
 ૧૯૭૩ાની સાહિત્યના અન્ધકાંદેલ્યાના કુદ્દપત્રાં કંપિ રૂપી,  
 નહીં કે મનુષ્યાની ક્ર. આની નાસુકથી એમજણા મારી,  
 'શ્રીવિકાન' હુંગ હુંગની હુંગ હુંગ ૧૯૭૩૦૭૦૮ પ્રેરાપ્રે જીવાં  
 છ. એહી વીમની હોડીન સરીઓ પરિણાત્મી ગૈંધીયી.  
 વીમના આર્થિક અને રાજકીય વર્ષાં મારી જોવી હુંગ  
 જીરની રૂકી હોય હોવી હુંગ વીરની વારતમાં અંગેજેન્ટ્સ.  
 પરિયમની શાદ્યનિક હોંદોંના સેંચ્યુલિની વિકાસ કરીએ  
 અને મારી હોંદોંની હુંગ હોરાપ્રે જ વિકાસ કરીએ. એને  
 એ હોરા હોમાની વારતમાં વીમનું આર્થિક અને  
 નાજુકીય વર્ષાં કાર્યક્રમ કર્યું હુંગવિદ્યા વિદ્યાનાં હોય  
 રાંધી કે ગોંડવિચારની મૂલાં જીવતરીયે નિર્જન ન  
 વગત હોંદોંના સેંચ્યુલિને અને શાદ્યનિકાલાને ગાંધી  
 કૃતાં લિખ્યાન પિચીત નજરું જુદ્યો હો. ગાંધી એ 'ચ્યાંગ  
 શાદ્યનિકાલાની પૂર્ણ અધ્યાત્મિક કુર્યાની વાત કરતાં હતા,  
 એમની મારી હોળ સીધાનાંથી અત્યારે દાખલ કરીએ  
 શાદ્યનિકાલા અધ્યક્ષાધ્યક્ષ હોય તોંદો વધારે હતી. ગાંધી  
 તો એ જુદી અપની વાદીની. નિર્જન વગત મારી એ  
 આંદોલની હો. વારતી હોંદોંના સેંચ્યુલિન અને શાદ્યનિકાલાની  
 વીમનાંથી એહીએ ઘઢી. વીરની જ વિકાસ નહીંનો વિદેશ  
 ઉદ્યોગાની પગાધારી, પૂરી વિકાસ વિદ્યા અધ્યાત્માની હતી. ગાંધી  
 પછીના વારતે એ મારી અપનાંએ. નિર્જન વગત વારતીય  
 શાદ્યનિકાલાની પૂર્ણ પરંપરા હતી, કોઈ 'ગૌપ સેંચ્યુલિન'  
 નાથું નાથું કુર્યાની રિમાયાતી હતી. 'ચ્યાંગ શાહીની કુપિતા'  
 અને નિર્જન વગતની કુપિતા વર્ષો જે કોઈ વારે મૌખી  
 તફાવ હોય તો એ વા હો. નિર્જન વગતની શરૂઆત પૂરીની  
 કુપિતાની જ એમની મુજબ વારા ગાંધી, એમ તો 'પ્રાભુરૂપ'  
 -૧૯ ડાયીની.

નિર્ઝન લગતની કવિતામાં છંદોવિધાન

નિર્ઝન લગત છંદ અને લય તિશે કેટલા ભગત છે જોનો  
૨. મકૈત પહેલા કાલ્યમંગળના નામ 'છંદોલય' પરથી જ મળે છે  
આ ભાગાનતા તેમના પ્રેમગીતની પદ્ધિતમાં પણ પ્રતેશી ભાગ છે.

'બે ફૂલ ફૂલયાં!

... શા દેછંદે થતિબંદ તુટયા'

૩. 'છંદોલય' (પ્રથમ સ્વાતૃત્તિ ૧૦-૫૭) માં પ્રથીમથેલા છંદોની  
યાદી પરિશીલનમાં મૂકી છે, જેના પરથી આપણે તારેતી શાકીજી  
કે:

\* વૃત્તોમાં કવિને પૂછી અને મિશ્રીપજનિ પ્રત્યે પક્ષપાત છે.  
\* કાલ્યમાં બે છંદ યોજવાના હેઠાં, ત્યારે તેઓ જોખ છંદ  
(દીન્દ્રવજા / દીન્દ્રવંશા / ઉપેન્દ્રવજા / વંશાર્થ) અથવા પમંદ કરે  
કે. તેની માધી બઢુણા વંતત તિલકા અને દુત વિલંબિત હોય છે.  
૪. તેની કલાપીની કેમ અને છંદ દ્વારા એવતાં 'અંડકાલ્યો' નિર્ઝન  
લગતે રૂબથાં નથી.

\* 'અંડ' વૃત્તોમાં તેમની વૂલિ શિખરિંગી તરફની રહી છે.  
\* મુક્ત પદ્ધેમાં તેમને દરિગીત કે ઝલકાના પરંપરિત તિશેલ  
અનુસૂચ આવે છે.

૫. છંદ - પમંદામાં કવિનું કૌશાલ્ય  
૬. ક. ડાકીર અને નિર્ઝન લગત (વથમાં પુર્વ દ્વારા હોતા છુટા)  
એકમેશ્વરની નિકટ હતા. ડાકીર તિશે લખાયેલા કર્કોણ કાલ્યોમાં નિર્ઝન  
લગતે ડાકીરને પ્રિય કેવા છંદ (પૂર્ણી) અને ક્વર્ષપ (સ્થોનેર)  
ની ઉત્તીયા રહી છે. ('પિતામદ તમે અને વિશ્વાસ હું કલાસ્તાનિમાં')  
ગલીર લાટાલેઅન માર્ટી ઉદ્ઘૂરુત ગોતા પૂછી છંદની વરણી કવિએ

'વિદાય' મોને માટેય કરી છે. ('વિદાય, પ્રિય કૃપના, અત વિદાય દેવી મધ્યી!')

'કંદ્રોના (થારમાં) રચનામાં કૃતિઓ કાઠાળા પંથીની વાત કરી છે. લાભાર્દ્ધા પંથીની વાત કરતી હીએ તી. પંક્તિઓ પદ્ગ લાંબીદુંકી જોઈશે, માટે કૃતિ પરેપરિત હરિણિત પ્રમાણ કર્યો છે:

'હું આ લીલા!

શી ક્રિનગધ સુંદરની લીલા!

... જ્યારે સહગતું ખાલ માંથી ને નીચે સૂક્ષ્મ ધરા  
જ્યારે ગીલા લાગી શીઠલ જલના ઝ્રો !"

સિદ્ધની હાંકારી હિંમણ ગતિ બતાવવા કૃતિ (જીમા) કાલ્ય ગુલબંડીમાં  
રહ્યું છે:

'હું છલંગ, શૈજ રહીર,

નેત્રમાંથ હું જ તેજ, હો જ તોર'

જ્યારી કાલ્યની અભાર નલિન રાતની આજ છંદમાં રહોલા કાલ્ય  
'જીમા સુંદરી' ઉપર જોઈ શકાય છે. (નલિન રાતણા કાલ્યમાં  
જીક્રે વધુ લ્યંજનાલ્યાપાર છે.) ('હેઠ્લેરિયમસાં' કાલ્યમાં માછલીની  
દુંકી છ્વક્ષર સુભૂતવા કૃતિ ગુલબંદીને કામે લખાઓ છે :

'તેંતેંતમાં જ ગાઉ ગાઉ માપવા

ખાને ન ક્યાંય હૈંચવું'

'પ્રવાલદ્વીપ મંગ્રહનાં જીજેંથ ઘણા કાલ્યી ગુલબંદીમાં રચાયાં છે,  
ને મુંબઈનગરીની ફૂતગતિ સાથે સુમંગલ છે. જુથી 'હેઠ્લોમ વર'  
થી ઉડતી આ પંક્તિઓ:

'આ વિહેંગ'

... શી પલંબ કાળ !

પાર્ગાહિન વૃદ્ધાની અછી વિવાહ સાગ !'

ચતુરકારી સંધિથી રવાતો તનતેલી છંદ પણનાટક માર્ગ ઝાનુકુળ  
 છે. તેમાં લઘુ- ગુરુના બંધાન નથી, પંક્તિઓ લાંબીદૂકી રથી શકાયા  
 છે તનતેલીમાં ભર્જિયેલા રાગોરતા નાટક 'બિત્રાંગદા' ની નિરંજન  
 લગતે તે જ છંદમા રથનુવાએ કર્યા છે. ઉમાશંક જીશી કર્યે છે  
 તેમ રાગોરની 'ખપૂરભુંડે નાણાકૃતિનો' રથા રથનુવાએ ખોઝ 'ખાણનાદે  
 ભિદિ' છે. 'બિત્રાંગદા' ની ડ્રિલ, મંદ્રફૂતપ્રભુરે, સમાસયુક્તન લાખા  
 ટકાર ચાલે છે. મંતાણી ઊમીરસિત છે વીરાંગના બિત્રાંગદા ખર્જુનની  
 પ્રેમ ભંપાદન કરતા હેતુ, કામહૈલ પામેથી ખોઝ વર્ષ માર્ગ  
 રૂપતતી બનાવાનું લરદાન મેળવે છે. વર્ષને ખાંતે રથતર્ફંડન  
 ડોલીને ત ખર્જુનને કર્યે છે.

હું છું બિત્રાંગદા, રાજેન્દ્રનંહિની.

દૈવી નથી, તી નથી હું ભાખાન્યા રમણી!  
 પૂજા કર્યે રાખ્યો સાથી ખૈવીયે હું નથી.  
 રાખ્યી મૂકી

ખૈવીય હું નહી....

સુખે દુખે કરો મને સહરારી,  
 ત્યારે જ મારી પામી રાકશી પરિચાય."

જ છંદીના ભાલ ઉઠાવતી પદાવલી

પદંદ હરેલા છંદમા કર્તિ, ભસુદિત પદાવલિ પડે, સાશળ થયો  
 હીથ તેના ક્રિદ્રાગ હતે જોઈશે:

સ્ત્રતંકતા મળ્યાના બરાબર ખોઝ વર્ષ પણી રચાયીલા  
 દીદિકાયી 'મંસુતિ' માં જ્ઞા પંક્તિ વારેતારે ખાતે છે:

'ખાજ થી મંસુતિ! મંસુતિ! મંસુતિ....'  
 ઝલાટગાના 'દાલદા' બીજના ખાવતનથી લાવણા કિતમા  
 સુતિવલથી ફેલાય છે, ઇલાતાં ભાર છે.

એડ શિઅરિંગ્સિમા રવાટેલા 'રોષ ઝરણગા' ની પંજિઓ જુઓ,  
 'જુખો વેલી નેથા... તરબગતિ મંગાર કર્યા', 'કળી હોમા જૂદ્યા  
 પવન, પળમાં તી તઢી જી', છંદમા ખાવતા પાંચ ઉધૂસણાની પર  
 'તરબગતિ' એને 'પવન, પળમાં' મુશીને કવિઓ મરણતી જતી  
 નાહઠીની વેગ તાદેશથા ફરી રાખ્યો છે.

ગુલબદીમા રવાશીલા 'ગર્વિશૃદ્ધિ લોકલમાં' કાલ્યાની છા।  
 પંડિતણી કાને માંડતાં, રૈનની ગતિ મંલગાય છે:

'વિલીલ લીલ ડીલતી, હિલીલતી,  
 ડિલીલ બીલ બીલતી.'

લર્ટ્ચરિના જાગીતા નિમાસાને કવિઓ '૨ પ્રીય', કાલ્યામાં  
 મિશ્રીપજાતિમાં હાળ્યો છે:

'૨ પ્રીત, લર્ટ્ચરિના ફીલમાં તુ મૂર્ત!  
 ૩ ધિદું તને, છલમથી! છુર, દા! તુ ધૂર્ત!'

એવા એને ખાગલા ખંડા ખાપકી કવિની છંદકુરાળતાને  
 પ્રમાણી, પરંતુ કાન્ત ખાદિઓ તેથાર ફરેલા વૃત્તાના ગજમાંની  
 નિરંજન લગત મોટો વળોં ખાપી રાખ્યા નથી.

થ. મુક્ત પદ્ય

નિરંજન લગતે અનુગંધીયુગીન કવિઓમાં અમેરસ  
 રહીને, પંડિતણો અનિયમિત માપની હીચ તેવા ઘંગાં કાલ્યોનું  
 કર્યું છે.

થ.૧. પરંપરિત ઝૂલણગા.

'દાબદા' પાંચ માત્રાની સંધિ છે. 'મંસુલિ' કાલ્યાની  
 પંડિતણીમાં એવા માંધિનાં શ્વેષથી લઈને સાત વાર  
 અાવતન થયા છે:

‘ ખાતે હૈ મુહિતદિન !

ખાજ તું જોઈ લી લાજ ક્રમ સ્વાનબીન !’

‘ છંદતિદાનની ભગમા પ્રમાત્ર ન હીતા છ્ણા, ખેટલું છે ,  
તેના ખાતર્તનીથી ભજયિલી દૃતિખોની શાચ્ચ ખંડ રમા  
કરી છે .

૫.૨.

‘ દાલદાલ ’ માત માત્રાની (મલઘલ) સંધિ છે . તેના  
ખાતર્તનીથી ભજયિલી દૃતિખોની શાચ્ચ ખંડ રમા કરી છે .

૫.૩.

‘ મુખબંધી :

‘ લદા ’ કરા માત્રાની (સ્રિલ) સંધિ છે . તેના ખાતર્તનોથી  
ભજયિલી દૃતિખોથી શાચ્ચ ખાપણ ખંડ રમા કરી .

૫.૪

સ્ટેપ :

ખાલ માત્રાના ખાતર્તનોથી ફેલાંઓ ફાલ્યો રખાયા છે :

‘ મુજ મુજ્ઝ દે એનું ગંઘલ પંખી  
રિર ભુન્દરને જંખી .

... જેથી નથેનની પાંખ પમારી લમતું,

જેને કયાય ન ગમતું ,

... ખાત તૃતે ખોણી તૃઠુગા ।

તવ દર્દિનથી હે દૃઠુગા !’

૫.૪.

વનવેલી:

યતુરક્ષારી સંદ્ઘિનાં આવર્તનિથી કવિઓ રહેલાં કાલ્યોની વર્ષ  
ખંડ ૨ અને ૮ માં સમાવિષ્ટ છે.

૫.૫.

ગધકૃતિા:

કાલ્યને માટે પદ્ય અનિવાર્ય નથી. (કાલ્યમાં ગધકૃતિા એ પદ્યમાં)

'લીલસ આદ ગ્રાસ' વડે વીલ્લ તિહિંમેને ૧૮૫૫ માં અંગ્રેજી  
ગધકૃતિાની શરૂઆત ઉરી હતી. ઓગડકીસમી સંદ્ઘિનાં  
ઉત્તરાર્થમાં બોદલેર આદિ ફેન્યુ કવિઓ પડા ગધકૃતિા ર્યતા  
થયા હલા. ૧૮૪૩થી કાલ્યો રથનાર નિરંજન ભગતે ડેવન  
પદ્યમાં સર્જન કરીને ગધકૃતિાની બોંદી લાંગવાનું કાર્ય  
ગુલામમોહમ્મદ શીખ અને અન્ય માટે રહેવા દીદ્યું.  
કવિઓ અંડ શિશ્વારિકીમાં ચાર કાલ્યો રથ્યાં છે:

'તને કે ક્વાણોને

કહે, હું તે કોને

એં - એવે તું ને સ્વભ તુજમાં જેદ રહું લ્યાં ?'

અંદીં શિશ્વારિકીના પ્રચમ યતીઅંડની બે પંડિતી પંછી તે  
છંડમાં પૂરી પંડિતી મુકાઈ છે. આ પ્રચીગ વડે નિરંજન ભગત  
કાન્તના પગલામાં પગલું તો સૂકે છે, પડા એથી આગળ  
વધી શકતા નથી. દ્વિજવજના વાંચ અક્ષાર પછી શૌલાની  
ચલિ વારે છે. તેના પ્રચમ કે દિતીય યતીઅંડમાં પંડિત રથીને,  
કવિઓ અંડ દ્વિજવજ કર્યો છે.

‘એ ગીતગીવી

રાસે રમાડો, વજુકું લોવી

આ કૃષ્ણ શો કાળ જતો અગોલો !’

કૃવાયે દીજુવજ આને વસંતનિલકામાં દિદંદી કાચ્યે ૫૪૮  
રખાયુછે :

‘તું દાદથી બાકુ સુણાલની હૈ !

ઘંધારને તેજ થડી રસી ગઈ,

તારે સ્મિતે શાંત નિશા હસી ગઈ,

તું દૂરની દ્વિતીજ પણી વાસની હૈ !’

અંડ દીજુવજ લેમજ દીજુવજ - વસંતનિલકાનો દિદંદી ધરાવતી  
સુદુરમૂના ‘કાચ્યબંગલા’ (૧-૩૩) ની નિશ્ચાલિભિત પાંડિતાઓ  
વાંચવાથી જુપાશે કે આ બંને બાબતે નિરંજન બગાતે કોઈ  
નવપ્રસ્થાન કર્યું નથી :

‘એ ગીત ધારા

સંગીત ધારા

પ્રયંડ હેતી તવ કંદથી જે

ને આંગળીથી રાગઉરે ગુંચી જે

એ મિટ ને ભદ્ર પ્રસન્ન ગાડ્યાં

કુંચાં સુપાણાં પ્રિય પાઠક કુંડ હાયાં ?

(‘એ. કાંકર ઉસ્ત્રીય ૫૬૪ને)

વસંતનિલકામાં રહ્યેલા સોનેરની અંતિમ પાંડિતાં કરા  
અક્ષરનું ઉમેરડા કરીને કૃવાયે વાર્દીત વસંતનિલકાનો પ્રયોગ  
કર્યો છે :

‘રે સ્વામી શ્રી મદદ સત્યરહસ્યની સૂચી ખોલે !’

(8).

ચુંટી લેતાયેલા ઝૂલને સંબોધીને ડીવિએ વસ્તુનીનીલક્ષમાં  
સોનેદ રહ્યું છે:

'તારે ન રૂપ, નહીં રંગસુગંધ, કૃં ના....'

વસ્તુના અર્થો વનેવન હંસી રહ્યા છે, પડા ઝૂલ લો  
પાનખરની ડંગ્યા ઓઢીને પીઢી ગયું છે. છેભની પંક્તિમાં  
લાવપણયે સુયવવા કવિ છંદપણયો કવીને સગ્ધરા લાલ્યા છે:

'તારે પેલી ભચીની સમર્ડકાસુરલિ અંગારા મૃહેકે છે કેવી!'

૫.

### નિર્દોષ છંદવિધાન

નિરંજન ભગતના છંદો શુદ્ધ છે. તેમના છંદોમાં દીષ શોધવા  
એ ઘાસની ગંજમાં સોદ શોધવા જેતું છે:

'છુકેલો ઘેલો દક્ષિણ પવન જથાં આતુર ધર્યો,  
જોશાખરિષ્ટીની બા પંક્તિમાં 'દીક્ષાડા' શાબ્દમાં 'દ' પછી રાતિન  
આવતાં ચિત્રદીષ થાય છે.

'કશો તારે સાંપ્રત ન નહીં, નહીં દેણ તુજને'

અહીં 'સાંપ્રત' ના 'સાં' પછી ચિત્ર આવતાં ચિત્રદીષ થાય છે.

'નથી નિરખવી ફરી, પ્રથમ તો નિંહાપી ક્ષડો-

ડ અદ્યી ક્ષમ વા, વિશાળ નગરી વિશો, બાળતી....'

પહેલી પંક્તિમાં ચરકાંત ચિત્ર ધૂર્વે 'ક્ષડોડ' શાબ્દ  
પૂરોન થાયાં, અધ્યરા શાબ્દે વિલંબન કર્યું પડે છે, અને  
ઉચ્ચારડા કદરૂપું થાય છે.

દ્વાં આવવવા કવિને કર્યાંક કાળજીએ શાબ્દોના વિવિધોગ  
પણ્યા છે, જે વચ્ચા લાગે છે:

'એહ ('સ્વયં તું'), 'કુર્કોના (આરગાં), 'મિત્ર મિડિયાને'), 'ઈવાં ('સ્વયં તું'), 'કિયાં', 'હીહયાં' ('પાઇઅન્ટર'), 'જિર્દાં' ('અંગ્રેજ ઓન સીનાં વિધાચીઓને વિદ્યાય'), 'છે'ને બદલે 'છે' ('એક ઝૂલને'; 'એક્વેરિયામાં', 'મિત્ર મિડિયાને'). નીચેની પંક્તિઓ જુઓ:

'તને મેં સ્પશી રે જુવનરસની શીય તરસે  
વસંતે મહોરેલા મુદ્દિલ મનના મુંઘ પરશો!

પહેલી પંક્તિમાં 'સ્પશી' બને બીજી પંક્તિમાં એ જ તત્ત્વમ ડિયાપણું તદ્દૂરવ રૂપ 'પરશો' વિસંવાદી લાગે છે.

'ઈવાં તરે ફક્ત આ સદ, અલ્લ કલાંત'

'કલાંત' જ્યો સંભૂત શાદીની સાથે 'ઈવાં' નેવો દેખી શાદી છું સાચવવા માટે મૃદુવો પડ્યો છે.

### પરંપરિત હરિગીત

'દાદાલ્દા' (માલાલ) નાં યાર આવર્તનથી નેની એક પંક્તિ રચાય છે, તે હરિગીત છંદમાં ઓગડીસમી સ્થીમાં પુષ્કળ જેડાંગા ચચ્ચું હિતું. ('યાં જ્યાં નજર  
મારી છે યાદી ભરી ત્યાં આપની'). નિર્બજન બગતે અલાકાલ સીધિનાં અનિયતસેચ્ય આવર્તનો વડો, પરંપરિત હરિગીતમાં, 'સુધામણ વાગુણી', 'નાવો તમારો હાચ',  
'ભારલી', 'ધ્રુવનારા' વગેરે ડાંચોનું સર્જન રૂદ્ધ છે, જેનાથી અતુગાંધીયાના કવિઓ પ્રભાવિત ચચ્ચા હતા. 'પાત્રો'  
દીર્ઘકાચ્ચ પડો આ જ છંદમાં રચાયું છે. રિલેઝ 'વોદીસિસ' નામે કાંચશુદ્ધ ઉચ્ચાં હતું. જેમાં લિલારી, અંધળો,

રક્તપાતિઓ, વેશ્યા અને ફેરિયાની ઉક્તિઓ છે. રિસ્કેનો  
 હાડિયર કહેછે, 'થો સે નથિંગ કેન હેપન, થોસ ગુડ.  
 નથિંગ કેન હેપન? નિરંજન લગતનો ફેરિયો કહેછે, 'નોકે મને  
 સૌ ફેરિયો કહે છે, છતાં ફરતો નથી, પડા એમનો મારું  
 નસીબે ક્યાં ફરે છે?' ('પ્રવાલદીપ'નાં કાણ્યો વાંચતાં પ્રશ્ન  
 થાય: કવિએ મુંબદિનાં માત્ર દુરિતનાં દર્શન કેમ કર્યાં?  
 બોદલે પેરિસમાં તેવાં જ દર્શન કર્યાં હતાં નથી?)  
 ખાંધપાં, ભિખારી વગરે પાત્રોની ઉક્તિઓ એમરક્ષિય  
 છે. 'પાત્રો'નાં છેદવિધાન વિશે રા.વિ. પાદક લખેછે,  
 'હરિગીતના પંક્તિ ખંડોને બોલયાલની બદકામાં ડાળને  
 (નિરંજન લગતે) એને બાબો વઠોડ આણો છે':  
 'આ હાથ ને સામે દ્યાર્યા  
 એ હાથને ઘઝારનો પણ હાથ  
 એના નેરલો લાયાર ને પામર ડ્યાર્યા'

### ૮. વનવેલી

'૩૩ કાણ્યો' ના પ્રકાશનના લગતાં પાંચ દાયકા પદ્ધી  
 નિરંજન લગતનો સંખ્યા 'પુનશ્ચ' પડે થાય છે, જેનાં  
 સાહેસાંજ કાણ્યો વનવેલી છેદમાં છે. હિંદોમાંથી  
 ઉત્તરી આવેલા મંચ્યામેપ છેદ 'કવિત' ના મણ પ્રકોર: મનસ્સ,  
 દિનાકરી એને વનવેલી મણીય છે એ ચાર. ચાર અક્ષરના  
 (ચનુરક્ષરી) સંધિયી ખને છે. નાટુ. ગુરુનો કોઈ મિથ્ય  
 નથી, માત્ર અક્ષરબંધ્યા ગડાવાની છે. ૩૩ અદારના

દીનાખારીમંનું ચતુરસ્કારી સંધિ રોડ એટ આવે છે. મારુંમાં અત્ય સાધી બાંન વાઈ મારું અભૂરનો બગતા, તે હું જે અભૂરનો એ રા.વિ. પાઠક દીનાખારી ચ્યાને મારું વિશે લાગે છે, 'ચ્યાઠ - ચ્યાઠ અભૂરે વિરામ છોટા' રાત્રિ ચ્યાઠે હું ચ્યાને ચ્યાને પ્રાસ ચ્યાઠે છે.) ૧૮૮૦માં કેશાવ હંદુલે ચતુરસ્કાર સંધિના ચ્યાનિ ચાતસંઝ્યા ચ્યાવતનાંથી બનપેલી દુદાની કરણા ક્રી, જેમાં પંક્તિઓ લાંબી હુંકી ચ્યાપી શકે છે, અને પ્રાસાની ચ્યાનસ્યકૃતા નથી. ચતુરસ્કાર સંધિના પહેલા ચંદ્ર ગ્રીજા અભૂર પર ચ્યાનુંજીમે પ્રદાન ચ્યાને ગારું તાલ દે. બનપેલીમાં ચ્યાનેલા મારું ખડોનો ચ્યાપારું ચ્યાન્યાસ કરીએ :

અંડ 'સ' (રમાણલાઈ નીલંકંદ)

'કાગિયો ચુદ્ધમાં જતા રોડાચા દ્વારી સુદ્ધા છે?

દીનનું ગર્જન થયે કેસ્ટરીએ ફ્યાના

અરી એવું કદી બન્યું છે? તચા મોવડ વાગે

ને લાગ ત્યા કોલે નહી એવું કદી જોયું છે?'

અંડ 'અ' (રમેશ પારેઝ, 'લાઝા રારણી વારતા', ૧૯૭૨ )

'કોઈ ચોઢું ચોઢું વાઈ બોલી ઉછ્યું હોય, 'ચ્યાય'

- એવું હૃપદું તળાવ

અને હાલથી લસોકુ જળ જળક લાખુ

કને જટાજૂટ કાડ

તલે ઘંટીચી હી ચોહીએ પોઠના પુડાય'

(લે ... અવાયસુ નગારે પક્યા દાડીચોના ધાય)

'... ચ્યારે, હું ને મારા લેસ

ચ્યાનું શાકરનું દેસ

ચ્યાને ધાલ.

ચંદ્ર ચ્યાંલો

ચંદ્ર કુજડીની દાર'

અડ 'ગ' (નિર્ણય વિગત, "કાવ્યાં દિરમાં," ૨૦૦૬)

કાવ્યાંનો કહું છું કે તમે કાવ્યાં દિરમાં વસો છો.

તમારું દર ઈંટ, માટીને પદ્ધયરંજ દર નથી.

શું એનો તમને ડર નથી ?

તમે તો હસો છો !

તમે ક્યાં સુધું છો ?

તમે તો ભસે ધૂદું છો .

સુરનજાં ડિરાજા કાચની ભીંતોને લેણીને,

કાંચાંચ કરુંચાંચ ભીંદી છેણીને,

કાળી ખોંચાંચ એને ધોળી છતને સોનેરી રંગો લીંપે ,

તમારો અંડ જગણગતો ઢીપે'

# સંપાદક નરેજન મગત

નરેજન ભગતની આપ્તિ સાકુ, મુખ્યત્વે 'હંદીલાય' અને બૃહતું હંદીલાય' તથા 'કુંતી ની જસુ ઝરવા આપ્તિ કુંતી ચે કાલ્યાના કર્પિ તરીકે અને પદી રોપાણાના પુખર અવધારી અને પુખળ વજા તથા અનુપાદક તરીકે શાકીયી દીઘે, પરંતુ તેથી એડ આથ સંપાદક પક્કા હતા. એમાંનું સંપાદની હૈ: (૧) બ.ડ. ડાકીએ અદ્યાત્માંથી (અત્યાર સાથે) (૧૯૭૫), (૨) કેટલાંડ કાલ્યી: સ્ક્રેનાર્ટ (૧૯૭૦), (૩) માર્કિયાનું મનીયાય (૧૯૭૦), (૪) કાલ્યી: શાલ પંક્જા (૫) કાલ્ય કીર્તિયા (૧૯૮૦), (૬) દાજેન્દ્ર શાલ: અદ્યાત્માંથી (અત્યાર સાથે) (૧૯૮૩), (૭) આર્કિલ્ય - સાધના (૧૯૮૫ - ૧૯૮૮), હૈન્ગાળી કોલમ (૮) 'ગ્રંપ' આમદિયક (૧૯૭૭), (૯) 'આર્કિલ્ય' આમદિયક (૧૯૮૨ - ૧૯૮૫), (૧૦) કોલ્ટાંડ ભર્દ: અદ્યાત્માંથી (૨૦૦૫), (૧૧) પ્રીષ્ઠ ન્હાનાલાન (અત્યાર સાથે) (૧૨) પ્રીષ્ઠ ઉમાંદર જીર્ણી (અત્યાર સાથે) (૨૦૦૮), (૧૩) પ્રીષ્ઠ દા.ધ. પાડ્ડ (અત્યાર સાથે) (૨૦૦૯), (૧૪) દલીલી પિલેણ (અત્યાર સાથે) (૧૫) પ્રીષ્ઠ બળવંતશાલ (અત્યાર સાથે) (૨૦૧૦).

ભગતસાહેબની આલીગનશારી અને વિષયને આરે દેંક્ષી મેવાની પદ્ધતિ છેવી હીની કે ભાગથી જ કર્યું બકાએ એકો ભાગ. એરલે એમકો આપ્તિ આપ્તે કરેલાં સંપાદનીમાં પુસ્તકનું પરિપુર્ણ નહીં કરલામાં તેથી મુખ્ય ખરા, પક્કા પદી પ્રકારાન સ્કુલામાં તી એમની આમની આમની અલાકાદકાણની જ રહ્યી હીથી એ સ્વાલ્યાયિક હી આપણી બેદી શાકીયે દીઘે કે એમકો એ સંપાદની સાથે ન છોકર્યું પસ્સંદ રહ્યું હૈ, કે જીમાં એમની પોતાની ખાલ પ્રકારની લગાપ કીલું. એરલે કુ વખતીપણતી વનાં કોકિનગત કુ સંસ્થાન સંપાદનીમાં તેથી માણ છીપણાયાની ખાતે જોકાઈ ગયા નથી. નરેજન ભગત બ.ડ.ડ. ની ગુરુત્વાચ્ય માણતા. એરલે એમની અદ્યાત્માંથી કાર્યમાં જોકાલા. ડાકીએનું પ્રોક્રિલ્ય, એમની કર્પિતા અને વિધીઓના બધાઓ બિલ્સી રહ્યે એ હીતે વિષાળ લીખકો પાસે આમંગણ છાપણી લીખો જોકાલા. સંપાદક તરીકે ભગતસાહેબની વિશીષ એ કે આરલા બદ્ધ આલગ આલગ લીખકીના લીખો ફીલો હાંસા, બજે ત્યાં સુધી પુનરાવર્તનને એમકો રાખ્યું હુંનું. બળવંતશાલ પુર્વીની એમની એમાદાદ પગાર કરવાનું એ રાંયું હતું.

એમના પુર્વખૂરિ દાની સમકાળીન એવા કર્પિ જી સુનદરમાં એવા વધાસંગુકોમાણી એમકો રકોલાંદ એકાધાર કાલ્યો પલ્સંદ રદ્દી અને એનું સંપાદન 'કેટલાંડ' કાલ્યો: સ્ક્રેનાર્ટ' એ નામે પ્રકારાત થાયું. ભગતસાહેબની એપાદન પદ્ધતિનું એમાં પ્રીષ્ઠ નિર્દર્શન હી પ્રાંભે ન કાલ્યોની પુષ્પમ પંડિતની છૂટાય. એ પદી, એરલે કાલ્યાના જીર્ખડ આપ્તે આમદાનુકમ અને સુનદરમ (ભુવનકમ) આપ્તી કર્પિ આ સપાદનના આપ્તિનામાં જિલાય અને સાહિત્યાના વિવધાધીઓ - રાખ્યાંની વિગતી રીથવા હાંસાં ન માણવાં પક્કે એવી વિશીષ કાળમ લેવાય હૈ. પુસ્તકાપનામાં આ પ્રકારાની કેવું તી હીથી ન પક્કા, એવી આપીસાથ આ કાલ્યો

લગતસાહેબ બાપે કે : ' શિવલાઈએ વીગના કાલ્યસંગ્રહનું પ્રકાશન અર્થું વીચું  
દિવચાર્યું હતું - બલકે વીચું મે દિવચાર્યું હતું અને શિવલાઈએ કલીડાર્યું હતું . આનખજા  
શિવલાઈનું વીચિંતું અને અક્ષાળ અપસાન વધું ન હોત અને વીમના જુવનકુળમાં  
વીમના ઠાપે જ વીગના કાલ્યસંગ્રહનું પ્રકાશન ઘર્યું હોત તો કદાચ વેગા-બાણ  
અને આંતર-સપરાપણી કોઈ લિંગ રૂપથે વધું હોત , ' શિવલાઈ કાર્ટ્રોનિસ્ટર કે કુદિ ?  
વીચો પ્રરન વધો રેવાલાવિક હે. લગતસાહેબ સપાટ રૂદું છે કે - શિવલાઈ ચાર્ટરાં-  
કર્વ નથી, ચિગાકાર-કે-કાં-કર્વ નથી, ચિગાકાર અને કર્વ હે. કર્વના અભાદ્યિત  
અધિકાર્યો કર્વ છે.' આમ તુહીને વીમનો કાળમાં શિવલાઈનાં ઉચ્ચા ઝૂટો અને  
ઉંઘત ધોરજો હતાં, વી પુર્ણતાના વ્યાખ્યાની હતા, વી પુર્ણતાવાદી હતા.  
વીચો વે કુરારાંદિય હતા. એમની કુદિતામા બાપ કે અનુભાવ નનઠીં, પણ ભય,  
દુંદ, બાધા-ઘધું જ સપરણ અને સુધ્યાફ હે.' વીમ પુર્ણતિરામ સાચે તહેયું  
છે. એક સંપાદક તરીકે લગતસાહેબની આ પારદર્શકતા અને સ્પાટ સમુજ્ઞ છે.

માનેન્દ્ર મેધાલીને અથું વીદો રિમતે ઉત્તમ સાહિત્ય પીરસધાનો  
ઓનમ આને પળ છે. આઠમા નવમા દાયકામાં વીમનો વ્યાપળા સ્થુર્મદ્દ  
કુદિયો હારા જુનરાતી કુદિતાના કોડિયાં પુગરાવેલાં. પ્રથમ સંપુર્ણ સંપાદન  
નિર્ણયન ભગતને સૌપીલું. વીમા ગચ્છ પાછક, ઉશાજૂસ, પ્રમશમ રાધળ,  
પ્રિયકાળત મલિયાર, આલમુકુંન દરે, હેક્કીલાઈ' પુરીદિલ, ઝુરેંગ દલાલ,  
દરીન્દ્ર દહે અને નુસમુખ પાછકનાં કાલ્યાની પુસ્તકાચ્ચી પુગર વઈ હતી.  
આને સંપાદક તરીકે લગત સાહેબને આમાં કશું કુરેલાનો અંગરા નહીનો.  
પરંતુ કૃાલ્યાની પુર્ણદી વી જ વી કરી આદૈનું વિધાન જાની રહેયું.

રાનેન્દ્ર શાહ : અદ્યારાન - ગુંઘમાં વીમની સ્વાચે સંપાદનમાં ધીકુ પરીખ પળ  
હતા. યંતે રાનેન્દ્રભાઈના મિશ્રો અને વીમની કુદિતાના અદ્યાસીચ્ચો. ચાદ રહે કે  
રાનેન્દ્ર શાહનો પુષ્પમ કાલ્યસંગ્રહ ' દ્વિજિ' ની પુષ્પમ આવૃત્તિ ૧૯૫૭માં પુગર વઈ રિઝે  
લગતસાહેલે પરિશિષ્ટમાં પુરીકું જાલ્યાની ખૂલ્યી ભતાહેલો અને આર્દ્ધવસ્તરાએ  
પહોંચી આપણો હતો ! અહીં આ ગુંઘમાં રાનેન્દ્રશાહની કુદિતાનાં તમામેતમામ  
પાસમાં આવી મય એ રીતે સંપાદન વધ્યું હો. કોઈ કરો વિધય સૌપીપો અને સમગ્ર  
આધ્યાત્મિક રીતે કર્યું એમાં જ કોઈ પકડ સંપાદકની કુસીટી હોય હે. નિર્ણયન  
ભગત આવી બાબતોમાં આચંતું તારીકું અને સ્પાટ નિર્જય લઈ શકતા. આ  
અદ્યાયનાંથી રાનેન્દ્ર શાહની કુદિતાને સમાજવાના અંગો કે દરવાજ ઓલી  
આપણા.

લગતસાહેબે 'સર્વેશ' આધ્યાત્મમાં ૧૯૫૭-૧૯૫૮ના વેવર્ષ 'સાહિત્ય-સાધિના'  
એ નામે સાહિત્યક સતંભ બયાના હતા. મિત્રધશાંતિ દીર્ઘિના આગ્રહપા એકાદ  
વર્ષ પુરતું વીમનો પરિથય દર્દેટના સામાચિક 'ગુંઘ' નું સંપાદક સ્પીકરીલું. પરંતુ  
આપળને કોઈ નિર્ણયની ઝુક્કાગળે ત્યાર પહેલાં તો વીમનો દીકી પળ દીદ્યું. એ  
પછી, મદાદે વર્ષમાં વીમનો 'સાહિત્ય' સાગરિકનું તંગીપણ સંભારવું અને  
સામાચિકો માટે ચોડુ જાનંદક રણી આપણો. સર્વતાં સાહિત્યમાંથી રૂં પસંદ રૂઢું, તૌની  
પાસીએ, કુદા રમણી શુ મેળપણું, દૂરિની ઉરધાવદ્યા રૂમ કરી રીતે એચિચત્વપૂર્વ

ગોડવળો એ જિરંગ ભૂતે કુશન જ કુદ્યા વિના સ્પાચી ચાલ્યું. પુછમ ચંદ્રુમાં 'મિતામરી' રીતે એમણે બજ્યું હંતું. 'સાહિત્ય કાલાનીત છે, કુશિલ્પ' નહીં. સાહિત્યનું કોઈ પગ સામાચિર એના શમગણા સાહિત્યમાં રોમણી હોલા છે. શમગણા પુકારાનની શમગણાલિમાં ને કુશી સાહિત્યનું સર્જન પણ હોય છેની એ શમગણા તંકાની શુદ્ધાલ પણ હોય એમંથી એને જ કુશી ઉતામ હોય એ પ્રસંઘ કુશાનું વાય. સંભવ છે કે આ સાહિત્યમાં રે કુશી ઉતામ હોય તે હુંમેશા મારેનું ઉતામ હોય-એને ન પગ હોય. સંભવ છે કે આ સાહિત્ય મહાન હોય-એનો ન પગ હોય. હુંમેશા મારેનું ઉતામ સાહિત્ય, મહાન સાહિત્ય એ એંતે એડ સુખા અજરમાત હૈ. એ તંકાની શુદ્ધારણાઓની કુશયં સર્જનાની અકૃચાચ્ચોની સરજાનાની એ સંગૃષાડિત એને તક્કાઝિતની કુશયં સર્જનાની સરજાનાની. એ સ્ફૂર્ણિદેવતાનું પરદાન હૈ.' આટ ર્વદ્વાદ્ય લુભિડા પણ કુશી કુશાલ્ય હૈ! પગાચાપળો નોંધ્યું પરદાન એ કે 'સાહિત્યના આ એ વાર્ણના ગાળામાં આપણને લાંબું ટક એવી યશાસ્વી મેઝિએ કે 'સાહિત્ય' માં પુગાટ દૂતાંદી મળી. એમાં જિરંગનનાગણો પુલાંપ પગ હરો. 'સાહિત્ય' માં પુગાટ પહેલી આ કુશાની સહેલાઈએ વિસરી શકાય તેમનથી; 'પાઢો' (ઉમારંગર મેધી), 'સંકંદર સાની' (રઘુપીઠ ચૌથારી), 'રિદ્ધા' વાળા લોળાબાઈ પરેલના નિંબંદી, 'જગજગાપણું તને' (રામેન્દ્ર શુદ્ધિ), 'શોદ' એને 'પીંગું ગુલાબ' એને કું ' (બાલશંકર ડાકુર), 'હીંળી' (ચાંગ મોદી) એને 'આલારસ' (ધીરેન્દ્ર), 'હીરો' (સતાંશુ)પ્રશાંદ્ર), 'કર્સનલેની વીરકી' (પોગેશ ચંતાદ્ર) એને કુફિ યસેશ દેવના હાયો.

'હરિશંદ્ર ભદ્ર : અદ્યાયનગ્ય' (૨૦૦૭) માં સંપાદક તરીકે એમણે કોઈ વિવોચ હૈય લાખો નથી. પરંતુ, હરિશંદ્ર એની કુલતાજે મૂલપત્રો લેખણે ને આપણી 'સાહિત્યાયલેડ' માં પુગાટ એલો તે મુક્યો છે. આમાં જકાસાહેબ કાલેલકર, બચ્ચુલાઈ રાપત, ઉમારંગર મેધી, નગીનદાસ પારેડ, લાલશંકર ડાકુર, સુરેશ દલાલ, ચુમન શાહ એને પુલિજ દરમ્ય ઉપરાંત હરિશંદ્ર એહના પરિપારજનીના જિઝી સમાપાયા છે. એમ મારો હે કે આ કુલતાજે વ્યક્તિત્વ એને કર્તૃત્ય વિશી લગભગ બધું આ ગુંપમાં સમાવાય વઈ ગયું છે.

'શ્રીએ રહાજાલાલ' (અદ્યાય સાચે) (૨૦૦૭), 'શ્રીએ ઉમારંગર મેધી' (આલારસ) (૨૦૦૮), 'શ્રીએ રા.પિ. પાઠક' (અદ્યાય સાચે) (૨૦૦૯), તથા 'શ્રીએ બળંતરાષ્ટ' (આલારસ) (૨૦૧૭) ને એ સંપાદનીમાં એમને રિમનલાય રિએહી એને લોળાબાઈ પરેલ કા હિંદુનીનો સાથ મળ્યો છે. સાચાયક છે કે લગતસહેલે એમાં રૂપરેણ દીરી આપી રહી આડોના સજી સંપાદકીયે મોટાલાગણી જવાબદારી ઉકાવી રહી.

આ બધાંને એંતે કુશાનું એમ પ્રાત પાય છે કે ભગતસાહેબ એડ નિદ્દાવાન, પારહર્દ્રાં એને અદ્યાસી રોપા સંપાદક હતા. એમની પોતાની નિસબતથી આ કાર્યો એમણે કર્યો છે. વાણકને કોઈ પ્રથમ વાય એ પહેલાં ને તે ગુંપમંથી ઉતાર મળી ભાવ એવી સજાતા મારો આ સંપાદની વાયો છે. પુલીક સંપાદનના સંપાદકીય તિંબો જીએલી તીચ આપ્યા ઉપકુમણી એંદ્રા મળી રહે. સમગ્ર આયોજન જ એંતું તે નથી એટીના સ૆ંપાદકી, યાસ તો આ કુશો તો દાઢી બધી કેળવતી તીચા પુસ્તકો જ આપી રહી. એને કેરલાંક સંપાદકી, યાસ તો અદ્યાપકોચે એકેદ સંપાદની કુરવાનું રાંગું રાંગું રાંગું છે. એમણે સંપાદનની શિક્ષણ શીખવા માટે પગ આ બધું જ જીએનું જ રહ્યું.

૪૪

## જ્ઞાનવિદી

જંમતારીખ - ૧૮ - ૫ - ૧૯૨૬,  
 જંમણ્યા ચને વલાં - અમદાવાદ  
 અવસાનતારીખ - ૧ - ૨ - ૨૦૧૮, અમદાવાદ  
 માતા - મેનાલુહેલ  
 પિતા - નરહરિલાઈ હિરેલાલ ભગત  
 લાઇચ્યો - અસ્કુલ્પર, અંજિલ

- ૧૯૩૨-૩૬ - પ્રાચીમિક શૈક્ષણિક છાયા પેટેલની પોળમાં કાળુંપુર  
 ચુલ્લિલિસિપલ શાળા નં. ૧
- ૧૯૩૬ - પિતાનો ગૃહસ્થાગ
- ૧૯૩૬-૩૮ - પ્રોપ્રાયટરી સ્કૂલ
- ૧૯૩૮-૪૪ - દામુસાઈ શુક્રલ માર્ક્યુમિક શાળા - લવચેતના હાઈસ્કૂલ
- ૧૯૪૨ - ૪૩ - ૧૯૪૪ની લડન - અસ્થ્યાસ ચને પરીક્ષાના  
 બિંદ્ઝાર ભગવદીયાર્થ પાસે સંસ્કૃતના અસ્થ્યાસ
- ૧૯૪૪ - મેટ્રિક ચચા
- ૧૯૪૪-૪૬ - એલ. ડી. આર્ટ્સ કોલેજ, અમદાવાદ
- ૧૯૪૬-૪૮ - એલ. ડી. કોલેજ, મુંબઈ
- ૧૯૪૮ - રંગોજ સાહિત્ય સાચો સલાલું ચચા (બી. એ.)
- ૧૯૪૮-૫૦ - એલ. ડી. આર્ટ્સ કોલેજમાંચી અનુસલાલન (એમ. એ.)
- ૧૯૪૮ - કુમાર ચચા
- ૧૯૫૦ - એલ. ડી. આર્ટ્સ કોલેજમાં અંગ્રેજના અંદ્રોપ
- ૧૯૫૩ - એલ. ડી. આર્ટ્સ કોલેજમાંચી રાજ્યનામુ
- ૧૯૫૩ - ગુજરાત લો સોસાયરીમાં આર્ટ્સ વિદ્યાગમાં અંદ્રોપ
- તરીકે નિયુક્ત ચચા
- ૧૯૫૬ - બી. ડી. આર્ટ્સ કોલેજમાં જોડાયા
- ૧૯૫૭ - 'નર્મદ સુવાર્ગા ચંદ્રક' 'દંડોલય' માટે
- ૧૯૫૭ - ૫૮ - 'સાંદેશ' ફેલિકની 'સાહિત્યસાધના' સાલાઈક કોલમમાં  
 લેખન
- ૧૯૬૦ - 'પરબે'એ રાંધ્રાદક - તંત્રી ગંડળમાં (નગીનદાસ પારેલ તચા  
 લ્યાન્ચરાય અંજારિયા સાચે)
- ૧૯૬૩-૬૭ - સાહિત્ય અકાદમી, જ્યુ ઇટ્ટીમાં ગુજરાતી ભાષા માટે  
 સલાહડાર સચચે
- ૧૯૬૬ - રમાજિલરામ સુવાર્ગાંદ્રક

- ૧૯૭૬ - ગુજરાતી સાહિત્ય પરિવદના રૂમા અધિકેશનમાં સાહિત્ય વિભાગના પ્રમુખ
- ૧૯૭૭ - 'બંચ' સામયિકનું સંપાદન
- ૧૯૭૮ - 'સાહિત્ય' ક્રમાસીકનું સંપાદન
- ૧૯૭૮ - ૭૮ - સાહિત્ય અકાડેમી, જ્યુ-ઇલ્હીની સામાન્ય પરિવદના સભ્ય
- ૧૯૮૫ - સેન્ટ ઝેવિએર્સ કોલેજમાંચી ગુજરાત સાહિત્ય અકાડેમીનો અભેદ
- ૧૯૮૮ - 'મુર્દૂન્ય સાહિત્યકાર' ગુજરાત સાહિત્ય અકાડેમીનો અભેદ
- ૧૯૮૯ - ૮૮ - ગુજરાતી સાહિત્ય પરિવદના પ્રમુખ
- ૧૯૯૮ - પ્રેમાનંદ સુપાર્સિયાન્ડ્રક
- ૧૯૯૯ - સાહિત્ય અકાડેમી, જ્યુ-ઇલ્હીનું (૧૯૮૮નું) પારિતોષિક  
- સ્વાદ્યાચાર્લોક ભાગ - પ્રદીપ : ગુજરાતી સાહિત્ય (પુર્વાર્ધ)  
અને ભાગ - દુ : ગુજરાતી સાહિત્ય (ઉત્તરાર્ધ) માટે
- ૨૦૦૦ - 'સાથીદાનંદ સંભાન્ન' ગુજરાતી સાહિત્ય પરિવદ
- ૨૦૦૧ - જરસિંહ મહેતા અભેદ
- ૨૦૧૫ - 'જાયભુદ્રા' વિનોદ લિવેટિયા અભેદ

### સાહિત્યસર્જન

#### કવિતા

- ૧૯૪૮ - 'છંદીભય' - નાગારી - ગુજરાતી લિપિમાં પ્રકાશિત
- ૧૯૫૦ - 'કિન્ધરી'
- ૧૯૫૪ - 'અત્યપિક્રામ'
- ૧૯૫૭ - 'છંદીભય' (સંકલિત)
- ૧૯૫૭ - પ્રવાલદ્ધીપ
- ૧૯૫૮ - ૩૩ કાવ્યો
- ૧૯૭૪ - છંદોભય (સમગ્ર/ભૂદન)
- ૧૯૮૭ - છંદોભય (દ્વિતીય આવૃત્તિ)
- ૨૦૦૯ - પુનરાદ્ધરણ
- ૨૦૧૨ - ૮૬, મે
- ૨૦૧૮ - અતિમ કાવ્યો
- ૨૦૧૮ - છંદોભય બ્રેન્ડ

#### ગાય

- ૧૯૭૨ - આધુનિક કવિતા.
- ૧૯૭૨ - કવિતા કાનચી લંચો
- ૧૯૭૫ - યત્કવિજ્ઞાન અને મંત્રકવિતા।

- ૧૭૭૬ - મીરાંલાઈ  
 ૧૭૭૭ - કાવી ન્હાણેલાને  
 ૧૮૭૮ - ડિસ્ક્રીટ. બી. રોડસ  
 ૧૮૮૧ - વી. એસ. બોલિરાટ  
 ૧૯૮૨ - મીરાં  
 ૧૯૮૭ - વિકાય છુગો  
 ૧૯૮૮ - વિકટર છુગોની સાહિત્યસૂચિ  
 ૧૯૮૯ - રાદ્યાયાયનોંક (બાગ ન થી)  
 ૨૦૦૪ - સાહિત્યચર્ચા

### અનુવાદ

૧૮૬૨ - The Vision of Yasavdatta

- ૧૮૬૩ - એકોત્તરશાતી  
 ૧૮૬૫ - ત્રિજાંગદા  
 ૧૮૭૬ - ઓડલનાં કાવ્યો  
 ૧૮૭૭ - રોબ-હિન્દુ - અંગ્રેજી લાઇબલ 'ધ લુક ઓઝ ધ જોન'  
 ૧૮૮૪ - અષ્ટાપદી - પ્રેલિશા - અંગ્રેજી પૃથી સેન્ટ જ્હોન ઓધ  
 કોસનાં આઠ મુખ્ય કાવ્યો

### સંપાદન

- ૧૮૬૮ - બ. ક. ડાઢોર અદ્યાયનગ્રંથ  
 ૧૮૭૦ - કેટલાંક કાવ્યો : સ્કૂનદરમ્  
 ૧૮૭૦ - માડિયાનું મનોરાજ્ય  
 ૧૮૭૮ - કાવ્યો - શિવ પંડ્યા  
 ૧૮૮૩ - રાજેન્દ્ર શાહ અદ્યાયનગ્રંથ  
 ૨૦૦૪ - શ્રેષ્ઠ ઉમાશાંકર : સમગ્ર સાહિત્યમાંથી ચચન  
 ૨૦૦૮ - શ્રેષ્ઠ ન્હાણાલાન : સમગ્ર સાહિત્યમાંથી ચચન  
 ૨૦૧૦ - ઉમાશાંકરનાં શ્રેષ્ઠ કાવ્યો  
 ૨૦૧૨ - રવીન્દ્ર વિવેચન  
 ૨૦૧૮ - શ્રેષ્ઠ બલબન્દરાય - સમગ્ર સાહિત્યમાંથી ચચન

### અંગ્રેજી

- ૨૦૦૨ - Coral Island : Bravaldveep  
 ૨૦૦૪ - Niranjjan Bhagat in English